

પ્રતાપ દર્પણ

RNI NO : 67531/97

મુદ્રક તથા પ્રકાશક : રાજેશ બાલુભાઈ પટેલ • તંત્રી : પ્રવીણ ગોહિલ • સહતંત્રી : જગદીશ વાલજીભાઈ ચાવડા • વર્ષ : ૨૮ • અંક : ૨૯૦ • મોબાઈલ નં. ૯૮૨૫૫ ૩૨૫૦૫

www.pratapdarpan.in

pratapdarpan_official

pratapdarpanstr@gmail.com

pratapdarpan_official11

મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહની હકાલપટ્ટીની શક્યતા

ફરી હિંસા ભેદકતા ભાજપના ૧૯ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને હટાવી દેવા વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો : ૫ જિલ્લામાં ફરિયાદો યથાવત

નવી દિલ્હી, તા. ૧૮
મણિપુરમાં ૩ મહિલાઓ અને ૩ બાળકોના મૃતદેહ મળ્યા બાદ હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન રાજ્યમાં ભાજપ સરકારનો હિસ્સો ધરાવતી નેશનલ પીપલ્સ પાર્ટીએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. એનપીના ૬૦ સભ્યોની મણિપુર વિધાનસભામાં ૭ સભ્યો છે, જેઓ ભાજપ સરકારને ટેકો આપી રહ્યા હતા. ભાજપ પાસે ૩૨ સભ્યો છે, જ્યારે બહુમતીનો આંકડો ૩૧ છે. આવી સ્થિતિમાં સરકારને હાલ કોઈ ખતરો નથી.

આ પહેલા ગુહમંત્રી અમિત શાહ નાગપુરમાં ચાર રેલીઓ રફ કરીને દિલ્હી પરત ફર્યા છે. તેઓ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક કરશે. તે જ સમયે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વડા અનીશ દયાલને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોકલવામાં આવી રહ્યા છે.

દરમિયાન, રાજ્ય સરકારે કેન્દ્રને આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) પાછો ખેંચી લેવા જણાવ્યું છે. હિંસાને કારણે, કેન્દ્ર સરકારે ૧૪ નવેમ્બરે ઈમ્ફાલ પશ્ચિમ, ઈમ્ફાલ પૂર્વ, જીરીબામ, કાંગપોકપી અને બિષ્પુર જિલ્લાના સેકમાઈ, લમસાંગ, લમલાઈ, જીરીબામ, લીમાપોંગ અને મોઈરાંગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં AFSPA લાગુ કરી હતી.

૧૬ નવેમ્બરે સીએમ એન બિરેન સિંહ અને ૧૦ ધારાસભ્યોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. બગડતી સ્થિતિને જોતા ૫ જિલ્લામાં કક્કું લગાવી દેવામાં આવ્યો છે અને ૭ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

દરમિયાન, કેટલાક મંત્રીઓ સહિત ભાજપના ૧૯ ધારાસભ્યોએ વડાપ્રધાન કાર્યાલય (PMO)ને પત્ર લખીને બિરેન સિંહને હટાવવાની માંગ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર જો આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ વધુ વણસી તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે.

૧૬ નવેમ્બરે જીરીબામમાં બરાક નદીના કિનારેથી બે મહિલાઓ અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. એવી શંકા છે કે ૧૧ નવેમ્બરના રોજ જીરીબામથી કુકી આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. ૧૧ નવેમ્બરે જ સુરક્ષા દળોએ બંદૂકધારી ૧૦ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે કુકી-જો સંગઠને આ ૧૦ લોકોને ગ્રામ રક્ષક ગણાવ્યા હતા. ૧૫ નવેમ્બરની રાત્રે પણ એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ખડગેએ કહ્યું- મણિપુરમાં ડબલ એન્જિન સરકાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- તમારી



અનુસંધાન પાના ૭ પર

વડોદરા સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના યુવાન પુત્રની હત્યા

હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ખૂની ખેલ ખેલાયો

વડોદરા, તા. ૧૮
વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નિપજાવી દેવાતા ચક્રચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળાં એકઠા થતાં પોલીસનો યુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહી તેના માટે પોલીસનો યુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) એ જણાવ્યું હતું કે, નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝડપ થયો હતો. જેમાં અમારા મહોલ્લાના વિક્રમ અને ભયલુ નામના બે છોકરાને વાગ્યું હતું. જેથી લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને આ બંને છોકરાઓને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું અને મારો દીકરો

યુજીસી ત્રણ વર્ષનો ડીગ્રી કોર્સ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો વિકલ્પ

ખૂની ઘરેડના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની શરૂઆત

નવી દિલ્હી, તા. ૧૮
યુજીસી ત્રણ વર્ષનો ડીગ્રી કોર્સ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો વિકલ્પ મળશે. યુજીસી ડીગ્રી કોર્સ ઓછા સમયમાં કરવાનો વિકલ્પ આપવા જઈ રહ્યું છે, સાથે સાથે ડીગ્રી પુરી કરવાનો સમય પણ એક વર્ષ વધારવામાં આવ્યો છે. આ બાબતે યુજીસીના અધ્યક્ષ પ્રો. એમ. જગદીશકુમારે જણાવ્યું હતું કે કમિશન ત્વરિત ડીગ્રી પ્રોગ્રામનો વિકલ્પ શોધી રહ્યું છે. જ્યારે સ્ટાન્ડર્ડ ત્રણ વર્ષની ડીગ્રીને ચાર વર્ષ કે ચાર

વર્ષની ડીગ્રીને પાંચ વર્ષ સુધી વધારવાનો વિકલ્પ પણ આપવા જઈ રહ્યું છે. ત્રણ વર્ષના ડીગ્રી કોર્સમાં એડમીશન મેળવનારાઓને પણ ચાર વર્ષનો કોર્સ કરવાનો મોકો મળશે.

જેણાં રિસર્વ ઈન્ટર્નશીપ કરે છે અને પોતાનો કોર્સ પુરો કરવાની સમય સીમા વધારવા ઈચ્છે છે, તેમને પણ આ મોકો આપવામાં આવશે. તેમનું કહેવું છે કે યુજીસીને વિશ્વાસ છે કે ચાર વર્ષના યુજી પ્રોગ્રામ ભારતીય ઉચ્ચ શિક્ષણમાં નવું ધોરણ બની જશે.

પ્રો. કુમારે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી ૨૦૨૦)ના વિઝનને દર્શાવે છે અને છાત્રોને અનેક ફાયદો આપે છે. ચાર

સરકાર દ્વારા વિતરિત કરાતું ૨૮ ટકા અનાજ ગરીબો સુધી પહોંચતું નથી

દર વર્ષે રૂ. ૬૬૦૦૦ કરોડના અનાજનો જથ્થો ગાયબે

નવી દિલ્હી, તા. ૧૮
દેશમાં ૮૦ કરોડ લોકોને મફત અનાજ યોજના ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થા મારફત નિયમિત રીતે વિવિધ અનાજ આપવામાં આવે છે. જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજ અને હુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે. તેમાં હાલમાં જ એક ઈકોનોમીક થીક ટેન્ક દ્વારા આપવામાં આવેલા તારણ મુજબ સરકારી વિતરણનું ૨૮% અનાજ એટલે કે રૂ. ૬૬૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. હાઉસ હોલ્ડ કન્સમ્પશન એકસપેન્ડીયર સર્વેના ડેટા અને હુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે તેના અભ્યાસ પરથી (ઓગષ્ટ ૨૦૨૩ થી જુલાઈ ૨૦૨૩ વચ્ચે) એ તારણ અપાયું છે કે ૨ કરોડ ટન ધઉ-



અનુસંધાન પાના ૭ પર

ન્યૂયોર્ક નજીક ઉડતા વિમાન પાસે એલિયન યાન પહોંચી ગયું

રહસ્યમય યાન અંગે પેન્ટાગોનના રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હી, તા. ૧૮
ન્યૂયોર્ક નજીક એટલાન્ટિક મહાસાગર ઉપર ઉડતું એક કોમર્શિયલ પ્લેન એક રહસ્યમય હવાઈ પદાર્થ સાથે અથડામણમાં થોડી વાર ચૂકી ગયું છે. પેન્ટાગોનના લેટેસ્ટ રિપોર્ટમાં આ ઘટના સામે આવી છે. અહેવાલમાં છેલ્લા એક વર્ષમાં ૭૫૭ અજાણી હવાઈ ઘટનાઓની વિગતો આપવામાં આવી છે.

એક અહેવાલ મુજબ પ્લેનના ક્રૂએ "એક નવાકાર પદાર્થ સાથે અથડામણની માહિતી આપી હતી." આ ઘટના ન્યૂયોર્કના દરિયાકિનારે બની હતી, જેની જાણ તેઓએ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ને કરી હતી. જો કે, ઘટનાની ચોક્કસ તારીખ અને એરલાઈનનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

પેન્ટાગોનની ઓલ-ડોમેન અનોમલી રિઝોલ્યુશન ઓફિસ (એએઆરઓ) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે.

નવી દિલ્હી, તા. ૧૮
પાટનગર દિલ્હી તથા એનસીઆરને ગાઢ ધુમ્મસ તથા ખતરનાક પ્રદુષણનો ભેવડો માર શરૂ થયો છે જેને પગલે ગ્રેડેડ રીસ્પોન્સ એક્શન પ્લાન-૪ (ગ્રેપ) લાગુ કરી દેવાયો છે. ૧૦-૧૨ સિવાય શાળાઓમાં ફીઝીકલ ક્લાસ બંધ કરાયા છે ત્યારે વાહનો ટ્રકની એન્ટી તથા બાંધકામ પ્રવૃત્તિ પર રોક લગાવી દેવામાં આવી છે. વિમાની-રેલ્વે સહીતની સેવાઓના શિડ્યુલ વેરિફેર બન્યા છે.

શિયાળાના આગમનની સાથોસાથ ગાઢ ધુમ્મસ છવાયાની સાથોસાથ પ્રદુષણની ચાદર છવાઈ

ગાઢ ધુમ્મસ સાથે દિલ્હીની હવા વધુ ઝેરી બની તા જનજીવનને વ્યાપક અસર

પ્રદુષણનું સ્તર અત્યંત ભયાનક સ્તરે પહોંચી જતા આજથી ગ્રેપ ચારનો કડક અમલ શરૂ કરી દેવાયો

ગઈ હતી. અનેક ભાગોમાં પ્રદુષણ ઈન્ડેક્સ (એર ક્વોલીટી ઈન્ડેક્સ) ૫૦૦ ની નજીક ૪૯૭ લેવલ પર પહોંચી ગયો હતો જેને પગલે આજથી જ નવા પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી દેવામાં આવ્યા છે.

એર ક્વોલીટી ઈન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં આવી જતા ધો. ૧૦ અને ૧૨ સિવાયના તમામ

શાળાકીય ક્લાસ બંધ કરી દેવાયા છે આજે સવારે અમુક ભાગોમાં પ્રદુષણ ઈન્ડેક્સ ૪૯૭ સુધી પહોંચ્યો હતો. શાળાના ફીઝીકલ ક્લાસ બંધ કરવા ઉપરાંત ટ્રકોને પ્રવેશબંધી તથા બાંધકામ પ્રવૃત્તિ પર રોક લગાવી દેવામાં આવી છે.

રાજધાનીમાં ૩૯ મોનોટરીંગ સ્ટેશનોએ એર ક્વોલીટી ઈન્ડેક્સ

દિલ્હીના ભયાનક વાયુ પ્રદુષણ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી

સરકારે સાવચેતી દાખવવામાં વિલંબ કરતા મામલો કોર્ટમાં

૪૫૦ થી વધુ હતો અને સરેરાશ ૪૯૧ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગાઢ ધુમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વીઝીબીલીટી અત્યંત નબળી રહેતા વિમાની-રેલ્વે સહીતની સેવાઓ પ્રભાવીત થઈ હતી.

સ્પાઈસ જેટ, ઈન્ડિગો જેવી એરલાઈન્સોએ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. ૩૦ થી વધુ ટ્રેનો ૩ થી ૪ કલાક મોડી હતી. જ્યારે સવારનાં વિમાનો એક કલાક સુધી મોડા પડ્યા હતા.

કેન્દ્રીય પંચ દ્વારા જારી રિપોર્ટમાં

દિલ્હીની વર્તમાન સ્થિતિને જોતા તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.

૧૪ નવેમ્બરના રોજ એમિકસ ક્યુરીએ કહ્યું હતું- દિલ્હી સરકારે પ્રદુષણ માટે કંઈ કર્યું નથી. સ્થિતિ ગંભીર છે. દિલ્હી વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર ન બને. આ પછી કોર્ટે સુનાવણી ૧૮ નવેમ્બરે નક્કી કરી હતી.

આ મામલો દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદુષણ સામે તકેદારી સંબંધિત છે. જે એમ.સી. મહેતા દ્વારા દાખલ કરવામાં આવી છે. તે ઢગઈ રાજ્યોમાં વાહનોનું પ્રદુષણ, ધન

સીધા કરવેરાની ફુલ ૨૬.૧૩ લાખ કરોડની રીફવરી બાકી

મુંબઈમાં સોથી વધુ રૂ. ૯.૬ લાખ કરોડ અને ગુજરાતમાં રૂ. ૧.૯ લાખ કરોડની રકમ પેન્ડીંગ

નવી દિલ્હી, તા. ૧૮
દેશમાં કરવેરાના કલેકશનમાં સતત ઉંચો લક્ષ્યાંક અને તે બાદ થયેલી આવક વચ્ચે અગાઉની ટેક-રીફવરીમાં પણ સીધા કરવેરા ભોઈ સફળતા મેળવી છે અને ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર માસ સુધીમાં જૂના વેરા બાકીમાંથી રૂ. ૩૫૫૦૦

કરોડ અને વ્યક્તિગત આવકવેરાના રૂ. ૧૨૫૦૦ કરોડની વસુલાત કરવામાં આવી હતી.

હવે વસુલાતને વેગ આપવા માટે ઝોનવાઈઝ ટાર્ગેટ અપાયા છે અને તેમાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૮૦૦૦૦ કરોડથી રૂ. ૧ લાખ કરોડની વસુલાતની તૈયારી છે. ગત નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગે જૂની બાકી વેરા રૂ. ૭૩૫૦૦ કરોડની વસુલાત કરી હતી જેમાં કોર્પોરેટ ટેક્ષના રૂ. ૫૬૦૦૦ કરોડ અને પર્સનલ આવકવેરા રૂ. ૧૬૫૦૦ કરોડ સામેલ હતા.

હવેથી બેંકના ફોન કે મેસેજ છ આંકડાના નંબર પરથી આપશે સાચબર ફોડ રોકવા રિઝર્વ બેંકે કરેલી નવી શરૂઆત

મુંબઈ, તા. ૧૮

દેશમાં સાઈબર છેતરપીટીમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જ્યારે લોકોને તેમાંથી બચાવવા માટે હવે બેંકોમાંથી ફોન તથા મેસેજ આંકડાના નંબર પરથી જ આવાશે. લોકોને છેતરપીટીથી બચાવવા માટે રિઝર્વ બેંકે પોતપોતાનાં નંબરો પરથી ગ્રાહકોને ફોન કરે છે અથવા મેસેજ કરે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે બેંકોનાં જુદાજુદા નંબરોને કારણે સાઈબર માફીયાઓ ગેરલાભ

લેવાની કોશીશ કરે છે અને ભ્રમની સ્થિતિ પેદા કરે છે તમામ બેંકોના નંબર છ આંકડાના જ રહેવાથી દુરુપયોગ પર રોક લાગશે.

ગ્રાહકો બેંકોના વાસ્તવિક નંબરોને ઓળખી શકશે. રિઝર્વ બેંકના દિશા નિર્દેશનાં આધારે તમામ બેંકો અનુસરણ કરશે. રિઝર્વ બેંકે તાજેતરમાં જ હોસ્પિટલ તથા શૈક્ષણિક સંસ્થાનો માટે યુપીઆઈ પર લેવડેવડેની મર્યાદા વધારીને પાંચ લાખની કરી છે. યુપીઆઈનાં વધતા ઉપયોગ વચ્ચે સાઈબર ક્રાઈમમાં વધારાને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંક અનેક કવિધ પગલા લઈ રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ચંટણી પર્વે ચંટણી પંચે રૂ. ૧૪ કરોડનું સોનું ઝડપી પાડ્યું

નાગપુરમાંથી સોનાનો મોજા જથ્થો ચૂંટણી પંચ દ્વારા જમ

મહારાષ્ટ્ર, તા. ૧૮
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. આ સંદર્ભે મુંબઈમાં ૮૦ કરોડની ચાંદી બાદ હવે નાગપુરમાં ૧૪ કરોડથી વધુની કિંમતનું સોનું જમ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ૨૦ નવેમ્બરે મતદાન થવાનું છે.

જવેલરી અને બિસ્કિટના રૂપમાં સોનું ગુજરાત સ્થિત કેપની સિકવલ લોજિસ્ટિક્સ દ્વારા પરિવહન કરવામાં આવી રહ્યું હતું. ટીમ રસ્તામાં ચેકિંગ કરી રહી હતી ત્યારે વાહન પકડાયું હતું. આ શિપમેન્ટ ગુરુવરે ફ્લાઈટ દ્વારા નાગપુર પહોંચ્યું, ત્યારબાદ



અનુસંધાન પાના ૭ પર



પર્યાવરણ-વનમંત્રી મુકેશ પટેલના હસ્તે બરબોધનમાં બે એકર જમીનમાં ૧૬ હજાર વૃક્ષોની રોપણી કરાઈ

‘એક પેડ માં કે નામ’ અભિયાન સમગ્ર ગુજરાતમાં જન આંદોલન બન્યું છે : વન રાજ્યમંત્રી

સુરત, તા. ૧૮
ઓલપાડ તાલુકાના બરબોધન ગ્રામ પંચાયત તથા નેચર ક્લબ અને એસ.બી.આઈના સંયુક્ત ઉપક્રમે બરબોધન ગામની બે એકર જમીનમાં ૧૬૦૦૦ વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી અમુલ્ય સંબંધ માતા અને તેમના સંતાનો વચ્ચે રહેલો છે. માતાનું ઋણ કોઈ રીતે ચુકવી શકાતું નથી. પર્યાવરણ બચાવવાના ઉમદા અભિગમ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૫મી જૂન, ૨૦૨૪ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે આ ‘એક પેડ માં કે નામ’ અભિયાનની શરૂઆત કરીને સૌને વૃક્ષો વાવવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાને દરેક લોકોને માતાનું ઋણ અદા કરવા માટે એક પેડ માં કે નામનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો. આ અભિયાન

કોયલી ખાડી પર બોક્ષ ડ્રેઈનની કામગીરી ઝડપથી પૂરી કરવા માંગ

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખ્યો

સુરત, તા. ૧૮
વરાછા ઝોન-એ માં સમાવિષ્ટ વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓને બોક્ષ ડ્રેઈન પેક કરીને સમગ્ર વિસ્તારના નાગરિકોને સ્વચ્છ વાતાવરણ પુરું પાડવાના ભાગરૂપે સદર ખાડીને લક્ષ્મીપાર્ક સોસાયટીથી લઈને સાકેતધામ સોસાયટી સુધીની કામગીરી કરવાના ભાગરૂપે સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, સાકેતધામ સોસાયટી, લક્ષ્મણનગર સોસાયટીના રહીશો દ્વારા નિયત કરેલ લાઈનદોરી મુજબ તેમના મકાનો સ્વેચ્છાએ ઉતારી પાડેલ છે. તેમજ ગૌતમપાર્ક સોસા., સમ્રાટ સોસા., રાજલક્ષ્મી સોસા. અને સહયોગ સોસા. ના ઘણાં લોકોએ સ્વેચ્છાએ મિલકતો ઉતારી પાડવા રાજ છે, તેમજ મોટાભાગના અસરગ્રસ્ત મિલકતોના માલિકો દ્વારા તેમના મકાનો સ્વેચ્છાએ પાલી કરીને આ વિસ્તારના રહીશોને દાયકાઓથી રંજાડતી સમસ્યા માટે પોતાના મકાનોને ઉતારવાનું એક ઉમદા ઉદાહરણ પુરું પાડી વિકાસના આ કાર્યમાં સહકારરૂપી આહુતિ આપેલ છે. જેથી આ વિસ્તારમાં ખાડીને કવર કરી બોક્ષ ડ્રેઈન કરવાની કામગીરી ઝડપથી પુર્ણ કરી શકાય.

આ મુદ્દે પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, લક્ષ્મણનગર, અંજની સોસા., ઈશ્વર નગરમાં પાલિકા દ્વારા લાઈનદોરીનો અમલ કરાવવાની કાર્યવાહી શરૂ કરીને શાસકોના રાજકીય દબાણમાં આવીને પડતી મુકેલ છે., ત્યારે આ સમગ્ર ખાડીને કારણે લાખો લોકોના જાહેર



કામરેજના ખેતરમાં આગ લાગવાની વધુ એક ઘટના આજે પ્રકાશમાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં કામરેજના ખેતરમાં આગ લાગવાની આજે ત્રીજી ઘટના બની છે. કામરેજમાં આજે સવારે સાડા ત્રણ વાગ્યાના શેરડીના ઉભા પાકમાં લાગેલી આગને ફાયર ડીગ્રીડે પાણીનો મારો ચલાવી ઓલવી નાંખી હતી.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી

હવે યુનિ.ના વિવિધ વિભાગોમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરાશે

સુરત, તા. ૧૮
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના એસ.ટી.સેલ અને સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીની સૌને શુભકામનાઓ પાઠવીને જનજાતિ સમુદાયના વીરો વિશે વિદ્યાર્થીઓ અને સમાજને માહિતગાર કરવા યુનિવર્સિટી પરિસર તેમજ સંલગ્ન કોલેજો ખાતે કાર્યક્રમો આયોજિત કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત યુનિવર્સિટી દ્વારા તા. ૧૪ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આગામી યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં કળશયાગમાં ભગવાન બિરસા મુંડા અને રાણી

જમીન સંપાદનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરતા શિવાની ગોયલ

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સુરત, તા. ૧૮
સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાપંડમાં યોજાયેલી બેઠકમાં ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલી નગરપાલિકા વિસ્તારમાં



ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલ કઠોદરામાં શિક્ષક સજ્જતા સેમિનાર યોજાયો

ગુજરાતી ભાષાનો અભ્યાસ કરનાર પાસે ભાગ્યે જ શબ્દકોશ ખોવા મળે છે : રાજેશ ધામેલિયા

સુરત, તા. ૧૮
શિક્ષણ એટલે સતત નવું શીખતું રહેવું. જે હંમેશાં નવું શીખતું રહે છે, તે વિદ્યાર્થીઓને રસપ્રદ શિક્ષણ આપી શકે છે. આ વાતને કેન્દ્રમાં રાખીને દ્વિતીય શૈક્ષણિક સત્રના પ્રારંભે ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલ - કઠોદરા, સુરત ખાતે ‘શિક્ષક સજ્જતા’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ‘શિક્ષકનું કર્તવ્ય’ વિશે શ્રી રાજેશભાઈ સાંગણીએ, ‘આદર્શ તાસ’ વિશે શ્રી દિલીપભાઈ આંબલિયાએ અને ‘ભાષાસજ્જતા’ વિશે શ્રી રાજેશ ધામેલિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારના આયોજનમાં શાળાના ટ્રસ્ટી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરતમાં યોગ શિબિર કાર્યક્રમ પોંડસરા ખાતે ડાયાબિટીસ ગ્રસ્તો માટે ત્રણ દિવસીય યોગ શિબિર યોજાઈ

સુરત, તા. ૧૮
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે સુરત શહેરના પોંડસરા ખાતે તા: ૧૪ થી ૧૬ મી દરમિયાન ત્રણ દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થઈ છે, જેના ભાગરૂપે યોગ દ્વારા ડાયાબિટીસના દર્દીનો પરીક્ષણ કર્યા બાદ નિષ્પાત તબીબના માર્ગદર્શન અનુસાર, યોગ, પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસથી મુક્ત કરાવવાનો પ્રયત્ન અંતર્ગત શિબિરમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્દીઓને નિષ્પાત યોગ

માંડવીમાં કાણાઘાટ ગામે રૂ. ૨૨.૯૧ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે વિવિધ વિકાસ કામ શરૂ કરાયા

સુરત, તા. ૧૮
સુરત, શનિવાર: આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના કાણાઘાટ ગામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા મંજૂર થયેલા રૂ. ૨૨.૯૧ કરોડના ૧૦ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકામોમાં રૂ. ૭

નવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી

વ્યાજબી ભાવની દુકાનોમાં ગ્રાહકોના કે-વાયસી અંગે ચર્ચા

નવસારી, તા. ૧૮
નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઈ.જિલ્લા કલેક્ટર -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાપંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પુષ્પલતાએ લાભાર્થીઓને અનાજ સમયસર મળી રહે તથા એ. એ. વાય યોજના હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને વિતરણ વ્યવસ્થા, ગ્રામ્ય - તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ વ્યાજબી ભાવોની દુકાનમાં ગ્રાહકો માટે ઈ-કેવાયસી થાય તે અંગે ચર્ચા-સમીક્ષા

માંડવી આઈ.ટી.આઈ. ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી

નહેરુ યુવા કેન્દ્ર અને માય ભારત સુરતના દ્વારા યોજાયો કાર્યક્રમ

સુરત, તા. ૧૮
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના ‘નેહરુ યુવા કેન્દ્ર-સુરત’ અને ‘માય ભારત-સુરત’ ના માધ્યમથી સુરતના માંડવી ખાતે આઈ.ટી.આઈ. માં તા: ૧૫મીના રોજ ‘જનજાતિય ગૌરવ દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે માંડવી તાલુકાના ૧૦૦ થી વધુ યુવાઓએ ઉલ્લાસભરે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ જનજાતિય ગૌરવ દિવસનું મહત્વ તેમજ



પલસાણા તાલુકાના અંગોલી ગામ વાંકાનેડા ખાતે રસ્તાના રૂ. ૭૦ લાખના ખર્ચે પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.



ભારત વર્ષના મહાન ક્રાંતિકારી એવા ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે ઉપસ્થિતિ યુવાઓને માહિતગાર કરવામાં આવ્યા અને સાથે સાથે કેન્દ્ર સરકારના માય ભારત પોર્ટલની કાર્યપ્રણાલી તથા તેના લાભો વિશે પણ યુવાઓને માહિતગાર કરી તેમને માય ભારત પોર્ટલ પર પંજીકૃત પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અનુલક્ષીને આવેલા યુવાનોમાં એક કિવઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ આઈ.ટી.આઈ. માંડવી ના આચાર્યશ્રી ભૂપેશભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યુવાઓ સાથે એક પદયાત્રા રેલીનું આયોજન

ઈકો-સ્પેશિયલ: દેશના અર્થપૂર્ણ વિકાસ માટે જવાબદાર મૂડીવાદ ને આર્થિક સમાનતાનાં લક્ષ્ય જરૂરી છે

ભારતનું અર્થતંત્ર ભલે વિશ્વવ્યાપી સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાય, પરંતુ દેશની આર્થિક અસમાનતાનો પ્રશ્ન ગંભીર છે. આમ તો આ વિષય વિભિન્ન દેશ માટે પણ ચિંતાનો વિષય છે ત્યારે આપણા નાણાપ્રધાને વૈશ્વિક મંચ પરથી કરેલું એક નિવેદન વૈશ્વિક અર્થ-વિચારણા માગી લે છે.



રિસ્પોન્સિબલ કેપિટાલિઝમ (જવાબદાર મૂડીવાદ) આ શબ્દો તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઉચ્ચાર્યા ત્યારે એમણે એમ પણ કહ્યું કે વિરાટ અર્થતંત્ર સામે સમાનતા (ઈક્વાલિટી) બહુ મોટો પડકાર હોય છે. અર્થતંત્ર માત્ર ઊંચો વિકાસદર હાંસલ કરે એ પર્યાપ્ત નથી. એની સાથે ઈકોનોમી ઈક્વાલિટી-આર્થિક સમાનતા પણ વિકસવી જોઈએપ્રજાના દરેક વર્ગને સમાન તકો પણ ઉપલબ્ધ થવી જોઈએ. આવા શબ્દ સાંભળવા-વાંચવા બહુ સારા લાગે છે, પણ આનો અમલ ખૂબ અઘરો છે. જોકે આપણા નાણાં પ્રધાન એક વૈશ્વિક મંચ પરથી આમ બોલ્યા તે પ્રજા માટે આનંદની સાથે આવકારવાલાયક વિચારધારા છે.

વરસો પહેલાં જાણીતા અર્થશાસ્ત્રી વાણીલાલ ગાલોએ 'રંકનું આયોજન' નામનું એક પુસ્તક લખ્યું હતું, જેમાં આઝાદી બાદનાં ૨૫ વરસનું સરવૈયું રજૂ કરીને કેટલાક સવાલ ઉઠાવાયા હતા કે આ આઝાદીનાં ૨૫ વરસ બાદ રંક-ગરીબ પ્રજાની દશા શું થઈ ગયાં છે, જેમાં હજી પણ પ્રજાનો બહુ મોટો વર્ગ સંઘર્ષ કરી રહ્યો છે. ગરીબી ભલે ઘટી રહી

ફરક પડ્યો છે. ગરીબ-વંચિત વર્ગ પર ધ્યાન અપાઈ રહ્યું છે. એમને પૂરતી તક મળે એવી સતત વ્યવસ્થા થઈ રહી છે. એ સમયે 'રંકનું આયોજન' પુસ્તક એવા સવાલ ઉઠાવ્યા હતા કે તત્કાલીન ભારત સરકારે તે પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતીય લેખકના જ પુસ્તક પર ભારતમાં સરકાર દ્વારા જ પ્રતિબંધ? ખેર, આ પુસ્તક પછીથી ઉપલબ્ધ થવા લાગ્યું હતું. વિકસિત રાષ્ટ્ર એટલે આજના સમયની વાત પર આવીએ તો આઝાદીનાં ૭૫ વરસ થઈ ગયાં છે, જેમાં હજી પણ પ્રજાનો બહુ મોટો વર્ગ સંઘર્ષ કરી રહ્યો છે. ગરીબી ભલે ઘટી રહી

હોવાનું કહેવાતું યા દાવો કરાતો હોય (જે અમુક હદ સુધી સાચો પણ ખરો) તેમ છતાં હજી સંખ્યાબંધ બુનિયાદી પ્રશ્નો ઊભા છે. ખાસ કરીને આર્થિક અસમાનતાના કોઈ સચોટ કે નક્કર ઉપાય થયા નથી, ક્યાંક તો આ અસમાનતા સતત વધી રહી છે. ભારતની સરકાર હાલ ૨૦૪૭માં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનાં લક્ષ્ય સાથે આગળ વધી રહી છે, જ્યારે દેશ આઝાદીનાં ૧૦૦ વરસ (શતાબ્દી) ને ઊજવતો હશે. આ સમય સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો પડકાર સરકારે ઉપાડ્યો છે. જોકે વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યા ખરેખર શું એ રિલેટિવ-સાપેક્ષ સવાલ છે, કેમ કે વર્તમાન સમયનાં કહેવાતાં

વિકસિત રાષ્ટ્ર પોતે હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. મેક એઆઈ ઈન ઈન્ડિયા નિર્મલા સીતારમણ થોડો સમય પહેલાં મેકસિકોમાં એક ગ્લોબલ મંચ પરથી કહ્યું હતું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના અંદાજ મુજબ ભારત ૬.૫ ટકાના દરે વિકાસ કરશે, જે સાત ટકા સુધી પણ જઈ શકે છે. હાલ ભારત વિશ્વવ્યાપી ફારસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી છે. આ ગ્રોથરેટ સરેરાશ ગ્લોબલ ગ્રોથરેટ કરતાં બમણો છે. હવે ભારત ટેકનોલોજીના દિશામાં વધુ ઝડપ સાથે આગળ વધવા માગે છે, જે માટે અઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પર જોર આપી રહ્યું છે. આ માટે ભારત 'મેક અઈ ઈન ઈન્ડિયા' અને 'અઈ વર્ક ફોર ઈન્ડિયા'ના મિશન સાથે કામ કરી રહ્યું છે.

વૈશ્વિક સ્તરે હાલ માહોલ વધુ ને વધુ અનિશ્ચિતતા તરફ જતો હોવાનું જણાય છે. આર્થિક દૃષ્ટિએ પોતાને મજબૂત કરવા દરેક દેશ પોતાના પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને હાલ અમેરિકા પર સૌની વિશેષ નજર છે, ટ્રમ્પનું શાસન નવાં પરિમાણ સર્જે એવું જણાઈ રહ્યું છે. બીજા બાજુ ચીન રિવાઈલ-પુનરુત્થન માટે થનગની રહ્યું છે. રશિયાને પોતાની આગવી સમસ્યાઓ છે તો મિડલ ઈસ્ટના દેશો ગ્લોબલ સ્તરે પણ વધુ તનાવનું સર્જન કરી રહ્યા છે. આ બધાં વચ્ચે અનેક પડકારો વચ્ચે પણ ભારત પોતાની આર્થિક નીતિઓ સાથે આગળ વધી રહ્યું છે. હાલ મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે દરેક પક્ષ પોતાને મત મળે એ માટે પ્રજાને આકર્ષવા જાત જાતની ઓફર સાથે વાચન આપી રહ્યા છે, જેમાં આખરે તો સરકારી તિજોરીમાંથી જ એ નાણાં જવાનાં છે. આનાથી પ્રજા સ્વાવલંબી બનવાને બદલે પરાવલંબી બનશે. આને બદલે સરકાર રોજગારસર્જન પર ભાર મૂકે અને સતત તેના ગંભીર પ્રયાસ ચાલુ રાખે એ પ્રજા અને દેશ બંનેના હિતમાં ગણાશે. આ વાત માત્ર મહારાષ્ટ્ર જ નહીં, બલકે દરેક રાજ્યને લાગુ પડે છે. ખરા અર્થમાં વિકસિત રાષ્ટ્રની આસપાસ નિશાની છે.



વિટામીન 'M' (મોબાઈલ)

આજના જમાનાનું અતિ મહત્વનું વિટામિન, કે જેના વિના માણસ બેબાકળો બની જાય છે. જેની ઉણપ થવાથી કેટલાય ન સાંભળેલા કે ન જોયેલા રોગો થવા લાગે છે. જેમ કે આતુરતા, મિનિટે મિનિટે મોબાઈલ ચેક કરવો કે કોઈનો મેસેજ તો નથી આવ્યો ને! રાત્રે સુતા પહેલા પણ મોબાઈલ. પહેલાના જમાનામાં એક રીત હતી ઊંઠીને કરના દર્શન કરવા અને શ્લોક ગાવો કે, "કરાએ વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી. કરમધ્યે તું ગૌવિંદ, પ્રભાતે કર દર્શનB" પરંતુ કળિયુગમાં શ્લોક પણ અપડેટ થઈ ગયા છે. "કરાએ વસતે whatsapp, કર મૂલે facebook, કરમધ્યે tu Internet. પ્રભાતે Mobile દર્શનમ્."

પહેલા પોતાની જાત પર, પોતાના હાથ પર વિશ્વાસ હતો. એટલે કર દર્શન થતા હતા. પરંતુ આજે વિશ્વાસ Internet અને Google બાબા પર છે. એટલે હવે સૌ પ્રથમ Mobile ના દર્શન થાય છે.

કદાચ આપણે એ વાતથી અજાણ હશું કે રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠતા પહેલા અવ્યેતન મનની સ્થિતિ ખૂબ જ નાજુક હોય છે. જેને આપણે સોશિયલ મીડિયાના ભોજન પૂરા પાડીએ છીએ. અને આપી રાત દરમિયાન આ અવ્યેતન મન સોશિયલ મીડિયાના વમળમાં ફસાયેલું રહે છે. જેના પરિણામે માણસની આંતરિક સ્થિતિ ખૂબ જ ખરાબ થાય છે. અને તેનું પરિણામ થાય છે કે વ્યક્તિ આકામક બને છે. ગુસ્સો હાથવગો હોય છે. અંતરની પ્રસન્નતા મૂળજળ જેવી લાગવા લાગે છે. અંતે પરિણામ વિકૃતિમાં આવે છે. કેટલાય વાલીઓ આજે ફરિયાદ કરે છે કે બાળક સામે બોલતું થઈ ગયું છે. કોઈની વાત સાંભળતું નથી, માનતું નથી. આ બધાનું કારણ ક્યાંક ને ક્યાંક આ મોબાઈલ જ છે. ઘણીવાર એવા વિડિયો ફરતા થયા છે કે બાળકને મોબાઈલ નથી મળતું તો તે કેટલો બેબાકળો બની જાય છે. અને જ્યારે ફોન મળે છે ત્યારે તે શાંત અને ખુશ થઈ જાય છે. જાણે સબ્લિમિનાલને અનુભવ થયો હોય. તે પોતા પોતાના સમયનું ખૂન કરી રહ્યો છે તેની તેને જાણ નથી. અને કદાચ જ્યારે જાણ થશે ત્યારે અફસોસ સિવાય તે કશું જ નહીં કરી શકે.

મોબાઈલ ના વધુ પડતા ઉપયોગે માણસમાંથી માણસાઈ ઝુંટવી લીધી છે. શરીરમાં કેટકેટલાય રોગો થાય છે. શરીર બીમારીનું ઘર બનતું જાય છે. કારણ કે દરેક કામ આંગળીના વેઢે થાય છે. પ્રાર્થિક શ્રમ ખૂબ ઓછો થઈ ગયો છે. બાળકોની રમતગમત તો ખોવાઈ જ ગઈ છે. શરીર રમતો લુપ્ત થવાને આરંભે છે. બાળક કહે છે, "અમે તો હોકી રમીએ છીએ, બાસ્કેટબોલ રમીએ છીએ." એમ પૂછીએ કે, "ક્યાં રમવા ગયા હતા?" તો બાળકોના જવાબ આવે છે. "મોબાઈલમાં."

ધર્મતેરી કી! તાજ સમાચારો અનુસાર, ઓસ્ટ્રેલિયાએ પોતાની કન્ટ્રીના બાળકોનું ભવિષ્ય ખતરામાં જોયું, અને ત્યાં એવો નિર્ણય લેવાયો કે ૧૬ વર્ષથી નીચેના બાળકોએ મોબાઈલ જોવો નહીં. ૧૬ વર્ષથી નીચેના બાળકો માટે મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મારા મત અનુસાર ખૂબ જ સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે ત્યાંની સરકારને તેના દેશનું ભવિષ્ય પાંગડું બને તે પહેલા તેને બચાવી લેવાના પગલા ભર્યાં છે. સમય હાથમાંથી સરી જાય તે પહેલા સાચવી લેવાની સમજણ વિકસાવી છે. બાળકોનો સમય એ મનુષ્ય જીવનનો પાયાનો સમય છે. જો તેને યોગ્ય દિશામાં વાળવામાં આવે, તો તે પોતાના જીવનને, સમાજને અને દેશને ઉન્નતિના સ્થાન પર લઈ જઈ શકવાની ક્ષમતા રાખે છે.

આપણા દેશમાં પણ કોઈક આવા નિર્ણયો લેવાવા જોઈએ. કે જેથી આપણે પણ આપણા દેશના ભવિષ્યને યોગ્ય દિશા અને દશા આપી શકીએ.

ભાવિની રાહોડ 'ભાવાગ્નિ' અમદાવાદ

ગૂગલ મેપ્સમાં રિયલટાઈમ અપડેટપ્રદુષણના પ્રકોપનું પરિણામ

એક શહેર કે ગામમાંથી બીજા ગામ કે શહેરમાં જવું અત્યારે સરળ થઈ ગયું છે. એસી કોચવાળી ટ્રેનથી લઈ એરલાઈન્સ ફ્લાઈટની સુવિધાઓ હાથવગી છે. રોડનેટવર્કમાં પણ બેસ્ટ કનેક્ટિવિટીથી ઘણા રસ્તા ખરા અર્થમાં સમય બચાવનારા બની રહ્યા છે. ઘણીવાર બીજા શહેરનાં લોકેશન જોઈને મજા આવી જાય છે.

આવા જ અનુભવમાં થોડો ઓર વધારો કરવા માટે ગૂગલે રિયલટાઈમ અપડેટ મૂકી છે. જોકે, અત્યારે એમાં એક જ વિષય છે. એ છે પ્રદુષણ. દિલ્હીથી લઈને દહેરાદૂન સુધી, ઓખાથી લઈને ઓડિશા સુધી, કાશ્મીરથી લઈને ધનુષકોટી સુધી પ્રદુષણને કારણે પ્રજા પરેશાન છે. દરવર્ષે શિયાળામાં દિલ્હીની હાલત દયા આવે એવી બની જાય છે.

આ પરિસ્થિતિમાં ગૂગલે 'રિયલટાઈમ' ફિચર ઉમેરીને લાઈવ 'એક્સ્ટ્રાઈઝ' બતાવવા પગલું ભર્યું છે. ગૂગલ મેપ્સ પર હવે રિયલટાઈમ છબી (એર ક્વોલિટી ઈન્ડેક્સ) જોઈ શકાય છે. એક રિપોર્ટ એવું કહે છે કે, ૨ મિલિયનથી વધારે લોકો ગૂગલ મેપ્સ એપનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ રાત્રીના સમયે વધારે થાય છે. ખાસ કરીને, હાઈવે પર ટ્રાવેલ કરનારા લોકો ચોક્કસ સ્થળ સુધી પહોંચવા માટે એનો ઉપયોગ કરે છે.

ગૂગલ મેપ્સની એક નવી અપડેટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે એમાં લાઈવ ફીડ દેખાશે. જે રીતે આપણું વાહન ફરે એમ એમાં ટ્રેકિંગ થાય છે એમ જે તે સ્થળે પ્રદુષણની માત્રા જાણી શકાશે. એપ્લિકેશનમાંથી આ અંગેની ટિપ્સ પણ મળશે. આ ટિપ્સ અનુસાર



તકેદારી પણ રાખી શકાશે. ગૂગલ મેપ્સમાં દર કલાકે આ છબી અપડેટ થશે એવું કંપની કહે છે. આ ફિચર આપણે ત્યાં આ વર્ષે આવ્યું. ભારત સિવાયના દેશમાં એ ઘણા સમયથી કાર્યરત છે. મેપ્સમાં લેયર્સ આઈકોન પર ક્લિક કરી એર ક્વોલિટી ઓપ્શન સિલેક્ટ કરવાથી આ જાણકારી મળશે. આ સાથે ટિપ્સ પણ મળશે કે, એર ક્વોલિટી સામાન્ય છે કે જોખમી. એપ્લિકેશનમાં એ પણ અપડેટ આવશે કે, જોખમી આબોહવા વખતે ઘરની બહાર નીકળવું નહીં. આ સિવાય જો વાત કરવામાં આવે તો સ્ટ્રીટ વ્યૂની સાથે તે હવે લાઈવ વ્યૂ પણ આપશે. સૌથી ખાસ વાત એ છે કે, જે તે ડેસ્ટિનેશન જો ટ્રિસ્ટ સ્પોટ હશે તો એ લોકેશનનો પ્રાઈમ ટાઈમ બતાવશે. કયા સમયે સૌથી વધુ રશ હોય છે એ પણ કહેશે. સારી

વાત છે કે, હવે જે તે ડેસ્ટિનેશન સુધીના આખા રૂટને ઓફલાઈન સેવ કરી શકાય છે. ઓટો સેટિંગ એટલું મસ્ત છે કે, સાંજ પડતા જ ગૂગલ મેપ્સ ડાર્ક મોડમાં ફેરવાઈ જાય છે અર્થાત રાત પડી ગઈ છે. આવી રિયલટાઈમ અપડેટ ટ્રાવેલનો આનંદ વધારી દે છે. આ ઉપરાંત મેપ્સમાં હવે એડવાન્સથી જે તે હોટેલ, ધાબા કે રેસ્ટોરાં જે હાઈવે પર છે અને રૂટમાં આવે છે એને લોકેટ કરી શકો છો. નવા ધાબા કે રેસ્ટોરાં પણ જોવા મળશે. ગૂગલ મેપ્સ પર રેટિંગના ફિચર્સ પણ લોકોને મોટી ચોઈસ આપી દીધી. જે તે હોટેલ લોકેટ થયા બાદ એની અંદર કેવું બેસવાનું છે એ પણ જોઈ શકાય છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાનું થાય એ સમયે આવા ફિચર્સ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. કયા રસ્તા પર શું આવશે એની એડવાન્સ જાણકારીથી ઘણો ફાયદો થાય છે. મેપ્સમાં બીજા સારી વાત એ છે કે, વૈકલ્પિક રસ્તો પણ બતાવે છે, જેમાં સમયની ગણતરી કરીને જે તે સમય કહે છે. ખાસ કરીને જ્યારે નાઈટ ટ્રાવેલ કરવાનું થાય ત્યારે આ ઘણી રીતે ટાઈમિંગ બાબતે કામ આવે છે. પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, મેપ્સમાં જોવા મળતો સમય નોન-સ્ટોપ ટ્રાઈવિંગ કેલક્યુલેશન પણ હોય છે જ્યારે બે રાજ્ય વચ્ચે થતી ધાબા અંતરની મુસાફરીમાં બ્રેક અનિવાર્ય હોય છે. વાત જતાં રિયલ ટાઈમની થઈ રહી છે તો એ વાત પણ ખરી છે કે, મેપ્સમાં જે રૂટ પર ટ્રાફિક જામ હોય એ અગાઉથી એલર્ટ આપે છે. જે તે રૂટ પર રેડમાર્ક કરીને એલર્ટ કરે છે. આ સાથે એક મર્યાદા એવી પણ છે કે, જ્યારે ફોર લેન કે ટુ લેન રોડ હોય ત્યારે એ જ વે તે સ્કિન પર બતાવે છે.

'ખ્યાતિ'ની જીવલેણ કુખ્યાતિપએક હોસ્પિટલની કૌભાંડ- કથા

અમદાવાદમાં આવેલી 'ખ્યાતિ' મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલના કાંડે બળભગાટ મચાવી દીધો છે. ખ્યાતિ હોસ્પિટલે કડી તાલુકાના ભોરીસણા ગામે યોજાયેલા કેમ્પમાં આવેલા લોકોમાંથી જરૂર નહોતી એવા લોકોને પણ હાર્ટ પેશન્ટ ગણાવીને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને તેમાંથી સાત લોકોની હાલત બગડી ગઈ.

આ પૈકી ભોરીસણા ગામના ૫૬ વર્ષના મહેશ બારોટ અને ૭૫ વર્ષના નાગજી સેનમાનાં ખ્યાતિ હોસ્પિટલમાં મોત થઈ ગયાં. ખ્યાતિ હોસ્પિટલે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટે મળતાં નાણાંની લાલચમાં જરૂર નહોતી એવા લોકોની પણ એન્જિયોપ્લાસ્ટી કરી નાખેલી. ખ્યાતિ હોસ્પિટલના લોભિયા સંચાલકોની આ લાલચમાં બેના જીવ જતા રહ્યા.

હોસ્પિટલે પહેલાં તો આખી વાત દબાવી દેવા મથામણ કરેલી પણ મૂતકાના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો તેમાં આ પાપલીલા બહાર આવી ગઈ. ખ્યાતિ હોસ્પિટલનું પાપ છાપરે ચડીને પોકાર્યું પછી સફાળી જાગેલી ગુજરાત સરકારે દર્દીઓની સર્જરી કરનાર આરોપી ડોક્ટર પ્રશાંત વજરાનીની ધરપકડ કરી છે. ગુજરાત સરકારે ખ્યાતિ હોસ્પિટલને 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં'થી બ્લેકલિસ્ટ કરી છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તપાસ માટે રચેલી કમિટીના સભ્યોએ રજૂ કરેલા રિપોર્ટમાં હોસ્પિટલ અને ડોક્ટરની ગંભીર બેદરકારી બહાર આવતાં આ હોસ્પિટલમાં માલિક કાર્તિક પટેલ, સંચાલકો

તેમજ સર્જરી કરનાર ડોક્ટર સહિત પાંચ લોકો સામે વિવિધ ફરિયાદ નોંધવામાં આવી છે. બે મૂતકાના પરિવારોએ પણ મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદ દાખલ કરાવી છે અને બંને ફરિયાદને અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. 'સોલા સિવિલ હોસ્પિટલ'ના સિવિલ સર્જન ડો પ્રકાશ મહેતાએ સરકાર તરફથી એક ફરિયાદ નોંધાવી છે.

આમ તો આ કેસમાં પોલીસ પણ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં કશું નક્કર બહાર આવે છે કે પછી ભૂતકાળમાં બનેલી ઘટનાઓની જેમ બધું રફદફ કરીને ભીનું સંકેલી લેવાય છે એ સમય કહેશે, પણ આ ઘટનાને લીધે ભારતમાં સેવાનું ક્ષેત્ર મનાતા મેડિકલ સેક્ટરને પણ લૂણો લાગી ગયો છે અને દેવદૂત ગણાતા ડોક્ટરો નાણાંની લાલચમાં યમદૂત બનતાં ખચકાતા નથી એ સાબિત કર્યું છે.

નિષ્ણાતોની ટીમે મૂતક મહેશભાઈ બારોટ અને નાગરભાઈ સેનમાના રિપોર્ટ તપાસ્યા તેમાં બહાર આવ્યું છે કે, બંને ને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી

અંધાપાકાંડ બનેલા. એ ત્રણેય કેસમાં ઘણાં લોકોએ પોતાની આંખો ગુમાવી હતી. મોતિયાનાં ઓપરેશન કરવા માટે યોજાયેલા આ કેમ્પોમાં પણ જરૂર નહીં હોવા છતાં ઘણાંનાં ઓપરેશન કરી નાખવામાં આવ્યા હતાં કે જેથી સરકાર પાસેથી નાણાં લઈ શકાય. આ લાલચમાં લોકોએ પોતાની આંખો ગુમાવી હતી.

અમદાવાદની આ તાજી ઘટનાએ દેશના સરકારી તંત્રની નિંબરતા અને સંસ્કૃતિના પાછા પાછા છત્તી

કરી છે. ખ્યાતિ હોસ્પિટલે ભૂતકાળમાં આ રીતે કલોલ પાસેના શેરયામાં પણ મેડિકલ કેમ્પ કરીને જરૂર નહોતી એવા લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલે એક વર્ષમાં આ રીતે ઓપરેશનો તથા સારવારના નામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ૩.૬૬ કરોડ રૂપિયા લીધા છે. ખ્યાતિની કુખ્યાતિ જોતાં મોટા ભાગની રકમ તેણે આ રીતે જ ભ્રષ્ટાચાર કરીને પ ડાવી હશે એ ઉમેરવાની જરૂર નથી.

આમ જુઓ તો ખ્યાતિ બહુ નાની હોસ્પિટલ છે, પણ આ દેશમાં આવી તો સેંકડો હોસ્પિટલ છે. અને એમાંથી ઘણી હોસ્પિટલ આ રીતે ખોટાં ઓપરેશનો તથા સારવારના માટે 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' ના નામે ખોટી રીતે રકમો પડાવતા જ હશે એ જોતાં કેન્દ્ર સરકારની આ યોજનાની મોટા ભાગની રકમ તો ચવાઈ જ જતી હશે એવું માનવામાં જરાય અતિશયોક્તિ નથી.

કેન્દ્રની મોટી સરકાર દાવા કરે છે કે, કોંગ્રેસના શાસનમાં સરકાર તરફથી અપાતા એક રૂપિયામાંથી ૮૫ પૈસા ચવાઈ જાય છે એવું ખુદ રાજ્ય ગાંધીએ કબૂલેલું પણ અમારા શાસનમાં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થતો નથી ને પ્રજા માટેની પાઈએ પાઈ પ્રજા પાછળ વપરાય છે. ખ્યાતિ કાંડ જોયા પછી આ દાવો પોકળ અને એ કદમ હાસ્યાસ્પદ લાગે છે. બલકે કોંગ્રેસ શાસનમાં તો કમ સે

કમ ૧૫ પૈસા લોકો સુધી પહોંચતા હોય છે, જ્યારે ભાજપના શાસનમાં તો કશું લોકો સુધી પહોંચતું હશે કે કેમ એવી શંકા જાગે છે.

અહીં બીજો મહત્વનો મુદ્દો એ છે કે, ખ્યાતિ જેવી હોસ્પિટલ આ પ્રકારનાં કોમોડો ચલાવે ને કોઈને ખબર ના પડે એ વાતમાં માલ નથી, પણ સરકારમાં બેઠેલા લોકો, અધિકારીઓ વગેરેની મિલિભગતથી જ આ ધંધો ચાલતો હોય છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' સાથે જોડાયેલા ડોક્ટરો પણ તેમાં સામેલ હોય જ એ જોતાં આખું તંત્ર જ ભ્રષ્ટ કહેવાય. આખું તંત્ર ભેગું મળીને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટેની રકમ ચાઈ કરી જાય એ શરમજનક કહેવાય, તેમ છતાં કમનસીબે આ બધાંને ઊની આંધ પણ નથી આવતી ને અમુક કિસ્સામાં તો ખુદ ડોક્ટરોને બલિના બકરા બનાવી દેવામાં આવે છે.

રાજ્ય સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા ડોક્ટરો રાજ્યની અન્ય કોઈ હોસ્પિટલમાં કામ કરી શકશે નહીં. આ ઘટના સાથે જોડાયેલા ડોક્ટરો વિરુદ્ધ પગલાં લેવા ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ સૂચના આપવામાં આવી છે, પણ હોસ્પિટલના માલિકોને કશું થયું નથી. સરકારે એવું કહ્યું છે કે, હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી કે અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે પણ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ કાર્યવાહી કરાય એવી શક્યતા પણ ઓછી છે કેમ કે માલિકો તો તંત્રને પોષે છે.



તંત્રી લેખ... -

સોમવાર, તા.૧૮ નવેમ્બર ૨૦૨૪

ચૂંટણીપંચની વિશ્વસનીયતા

ભારતીય લોકશાહીમાં ચૂંટણીપંચની વિશ્વસનીયતા હંમેશાં ચાલી રૂપ રહી છે. ચૂંટણીનાં આયેજનમાં પંચની નિર્ણાયક ભૂમિકા સામે ઘણી વખત રાજકીય પક્ષો સવાલ ખડા કરતા રહે છે, પણ મતદારોમાં લોકશાહીના આ આધારસ્તંભ પરનો ભરોસો યથાવત્ રહ્યો છે. મોટાભાગે ચૂંટણીનાં આયોજનમાં પંચ સંખ્યાબંધ બાબતો ધ્યાનમાં લેતું હોય છે. મતદારોને અગવડતા નડે નહીં તે માટે ઉત્સવો અને શાળા-કોલેજની પ્રવૃત્તિઓ સુધારવાનું ધ્યાન રાખીને મતદાનની તારીખો નક્કી કરાતી હોય છે. તાજેતરમાં ચૂંટણીપંચે વિધાનસભાની પેટાચૂંટણીઓનાં મતદાનની તારીખોમાં ફેરફાર કરીને ભારે ચર્ચા જગાવી છે. આમ તો આ ફેરફાર અમુક પર્વ અને તહેવારોને ધ્યાનમાં લઈને કરાયો હોવાનું પંચે કારણ દર્શાવીને આ મુદ્દે ચર્ચાનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે. બન્યું એવું છે કે, કેરળ, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીની તારીખ બદલીને હવે ૨૦મી નવેમ્બરે મતદાન કરાવાશે એવી પંચે જાહેરાત કરી. આ ફેરફાર માટે અમુક રાજકીય પક્ષોએ પણ માંગ કરી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે, અગાઉની તારીખમાં મતદારોને મુશ્કેલી નડે તેમ હતી હવે જે નવી તારીખ નક્કી કરાઈ છે તેનાથી આશા રાખી શકાય છે હવે તમામ પક્ષો અને મતદારોને સંતોષ થશે અને કોઈ સવાલ ઊભો થશે નહીં. જો કે, હવે સવાલ એ થઈ રહ્યો છે કે, આ અગાઉ પંચે જે તારીખ નક્કી કરી ત્યારે તેણે તહેવારો આવશે એ બાબત ધ્યાને લીધી ન હતી શું? વળી તેને ત્યારે ખ્યાલ આવ્યો નહીં કે મતદારોને અગવડતા પડશે. ખરેખર તો આ સમયપત્રક તૈયાર કરતી વેળાએ પંચને જે બાબતો ધ્યાને લેવાની હોય છે તે આ વખતે લીધી ન હોય એમ તારીખમાં ફેરફારનાં પગલાં પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. આમે પણ તાજેતરના સમયમાં રાજકીય પક્ષો વિવિધ મુદ્દે પંચની સામે આરોપો મુકવાની કોઈ તક જાણી કરતા નહીં હોતા. આવામાં મતદાનની તારીખમાં ફેરફારથી આવા

રાજકીય પક્ષો ખફા થયા છે, એ સ્વાભાવિક છે. પંચે ખરેખર તો રાજકીય પક્ષો અને મતદારોના વિશ્વાસને જાળવી રાખવાની અનિવાર્યતા પર સંતત સભાન રહેવાની ખાસ જરૂરત છે. આમ પણ રાજકીય પક્ષો માટે ચૂંટણીપંચ હંમેશાં નિશાને જ હોય છે, એ કોઈ પક્ષના વડાની બેગ ચેક કરે ત્યારે બહાલ થતી જ આવી છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમ્યાન પણ આવા પ્રસંગો બન્યા જ છે, પક્ષો પણ ચૂંટણી પ્રચારના ધમધમાટમાં ક્યારેક ન બોલવાનું બોલી બેસતા હોય છે અને પંચ જો પગલાં ભરે તો તેના પર તડાપીટ નક્કી જ હોય છે. આપણા દેશ જેવા વિવિધતાભર્યા માહોલમાં ચૂંટણીપંચની કામગીરી તલવારની ધાર પર ચાલવા જેવી રહી છે. આવા સમયે પંચ આવીને નિર્ણયોમાં ફેરફાર કરે કે કોઈપણ પગલાં ભરે તેની અસર રાજકીય પક્ષો પર થવાની જ. આમ તો આગાઉ કહ્યું તેમ, સામાન્ય પ્રજાને ચૂંટણીપંચ પર વિશ્વાસ રહ્યો જ છે, પણ રાજકીય પક્ષો પોતાની ખીચડી પકાવવામાં પંચની વિશ્વસનીયતાને પણ દાવ પર મૂકી દે છે, ત્યારે પંચે વધુ સજાગ અને મક્કમ થવું જ પડશે.

રાજકીય પક્ષો ખફા થયા છે, એ સ્વાભાવિક છે. પંચે ખરેખર તો રાજકીય પક્ષો અને મતદારોના વિશ્વાસને જાળવી રાખવાની અનિવાર્યતા પર સંતત સભાન રહેવાની ખાસ જરૂરત છે.

સિંધુ સભ્યતાના જનક આર્યો જ હતા

સ્ત્રીઓ સંદર્ભે આપણી સામંતી માનસિકતા, સામંતી યુગ પૂરો થવા છતાં બદલાઈ નથી. આજકાલ તો સ્ત્રીઓ વિષે અશ્લીલ વાતો કે હરકતો કરવાનું અમુક વર્ગમાં સામાન્ય છે. જાહેરમાં સ્ત્રીઓ વિષેનાં અભદ્ર ઉચ્ચારણો પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. દુખદ તેમ છે કે આવી અભદ્ર ટિપ્પણી કરનાર નેતાઓ સામે સ્ત્રીઓ ને વિપક્ષો બળાપો ઠાલવવાં હોય છે, પણ જે તે પક્ષ એવા નેતા સામે કોઈ પગલાં લેતો નથી ને ક્યારેક તો એને છાવરે છે. એનો અર્થ જ એ કે સ્ત્રી કરતાં સત્તા સર્વોપરી છે. કમનસીબી એ છે કે આ રાજકારણ પૂરતું સીમિત નથી, પણ તમામ સત્તા સ્થાનો એનાથી પ્રભાવિત છે. રાજકારણીઓની માનસિકતા સામે મહિલાઓએ મોરચો માંડી સખત વિરોધ નોંધાવવો જોઈએ. સાધારણ રીતે ઘણા રાજકારણીઓને મહિલાઓ રાજકીય ક્ષેત્રે આગળ વધે એ ગમતું હોતું નથી. રાજકીય પક્ષો સત્તા હોય તો ટકાવવા અને ન હોય તો મેળવવા જીવવું આવવી જતા હોય છે. એમાં કોઈ સેવા કરે છે એવું તો સપનુંય પડતું નથી. ચૂંટણી જીતવી અને જીત્યા પછી સત્તા સુધી પહોંચવું એ એક માત્ર લક્ષ્ય પક્ષોનું હોય છે. સમય જતા હવે સ્ત્રીઓ સત્તા પર આવે છે કે ટિકિટ મેળવીને ચૂંટણી પછ લાડે છે. પુરુષોની જેમ જ સ્ત્રીઓ પણ હવે રાજકીય લાભ જોઈને પક્ષ બદલે છે. સ્પર્ધાનું ધોરણ એવું થયું છે કે સ્ત્રીઓ હવે પુરુષની બરાબરી કરે છે.

અંદ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયુડુએ તાજેતરમાં જ એમ કહ્યું કે અંદ્રમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે તો લોકોએ બે કે તેથી વધુ બાળકો પેદા કરવાં જોઈએ, જેથી તેમની સંભાળ રાખી શકાય. એમણે એ પણ ઉમેર્યું કે બે કે વધુ બાળકો ધરાવનાર જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકે એવો કાયદો રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે. નાયુડુએ એની પાછળનો તર્ક એવો આપ્યો કે ઘણાં ગામડાઓમાં વૃદ્ધો જ રહી ગયા છે અને યુવાનો ક્યાં તો વિદેશ ચાલી ગયા છે અથવા તો અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે, એથી યુવાનોની વસ્તી ઘટી રહી છે. બાળકો ઓછાં હોવાને કારણે એમ થયું છે. બાળકો વધશે તો વસ્તી સંતુલિત થશે. એક સમય હતો જ્યારે આ જ નાયુડુ વસ્તી નિયંત્રણની વાત કરતા હતા ને હવે વસ્તી વધારવાની હિમાયત કરે છે. એક સમૂહ લગના એક કાર્યક્રમમાં તમિલનાડુના મુખ્યમંત્રી સ્વામિને લોકોને અપીલ કરી છે કે પરિશીત યુગલો ૧૬ બાળકો પેદા કરે. મુખ્યમંત્રીએ ૩૧ યુગલોનાં લગ્નમાં ઉપસ્થિત રહેતા કહ્યું કે પહેલાં વડીલો નવવિવાહિતોને ૧૬ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાઓ- એવો આશીર્વાદ આપતા હતા, તેને બદલે હવે ૧૬-૧૬ બાળકો પેદા કરવાની જરૂર છે. ઉત્તર ભારતનાં રાજ્યો કરતાં દક્ષિણ ભારતનાં રાજ્યોનો પ્રજનન દર ઘટતો ગયો છે. સ્વામિને બેઠકોની સંખ્યાનો ઉલ્લેખ કરીને ઉદાહરણે એ પ્રગટ કર્યું કે ૧૦ લાખની વસ્તીએ ૧ સાંસદની જોગવાઈ છે. એના માટે સીમોંકન દ્વારા સીટોની સંખ્યા વધી શકે. ૧૯૭૧ પછી વસ્તી નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું. દક્ષિણનાં રાજ્યો એ અંગે સભાન થયાં ને એમણે વસ્તી નિયંત્રણમાં સફળતા પણ મેળવી. એની સામે ઉત્તર ભારત વસ્તી નિયંત્રણ મામલે પાછળ રહ્યું ને એની વસ્તી વધતી જ રહી. એને લીધે ઉત્તર ભારતની લોકસભાની સીટો વધી ને દક્ષિણ ભારતમાં ઓછી જ રહી. ઉત્તર ભારતનાં રાજ્યોની સીટ ૨૫ છે અને દક્ષિણમાં ૧૩૦ જ છે.

અમારા રસોડામાં પણ કેટલીક ઉપયોગી ચીજો હોય છે જેનાથી લાભ

ઘરે જ ફફ-ફોલ્ડની સારવાર કરો

અમારા રસોડામાં કેટલીક એવી ખાદ્ય ચીજો હોય છે જેનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કેટલીક બિમારીને ટાળી શકાય છે. સિઝનમાં ફેરફાર થવાની સાથે જ કેટલાક લોકોને તો લોકડાઉનની સ્થિતિમાં પણ શરદી ગરમીની અસર રહે છે. કોરોના

વાયરસનો આતંક રહેલો છે ત્યારે નાની નાની તકલીફ માટે તબીબ પાસે ભાગી જવાની બાબત પણ યોગ્ય નથી. હાલમાં તબીબ પાસે જવાનું ટાળવામાં આવે તે જરૂરી છે. જે લોકોને શરદી ગરમી ઉપરસની સમસ્યા છે તે લોકો માટે અમે કેટલીક વાત કરવા અહીં જઈ રહ્યા છીએ જે તેમના માટે ઉપયોગી રહી શકે છે. ઘરમાં રહેલી ચીજોનો ઉપયોગ કરીને શરદી ગરમીને બે દિવસમાં ઠીક કરી શકો છો. આ સ્થાનિક ઉપચારની બાબત ઠીક અથવા તો લવિંગ સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આ સામગ્રી આપના રસોડામાં રહે છે. આમાં આપને વધારે કોઈ નવી ચીજ કરવાની હોતી નથી. માત્ર તેને તૈયાર કરીને તેનો ઉપયોગ કરવાની હોય છે. બાકી આના ફાયદા તો તેમ બે દિવસમાં જોઈ શકો છો. હકીકતમાં આ સ્થાનિક ઉપચારને પાણી અને લવિંગ સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. ઔષધીના ગુણોથી ભરપુર રહેલા લવિંગ પર કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગ પણ કરવામાં આવી ચુક્યા છે. મેડલાઈન પ્લસના કહેવા મુજબ લોંગ દાંતની સફાઈમાં, પિડામાં પણ ઉપયોગી સાબિત થાય છે. ઉલ્ટી થવા અને પાચન સાથે સંબંધિત સમસ્યામાં પણ રાહત આપે છે. ડાયરિયામાં પણ ઉપયોગી સાબિત થાય છે. સોજાને ઉતારી દેવામાં પણ તેની ભુમિકા રહેલી છે. આને તૈયાર કરી રીતે કરવામાં આવે તેવા પ્રશ્ન બાદ આનો જવાબ એ છે કે આને તૈયાર કરવા માટે કોઈ



લવિંગ સામગ્રી એકત્રિત કરી લેવામાં આવ્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. બનાવવાની રીત એ છે કે સૌથી પહેલા એક વાસણમાં પાણી લેવામાં આવે છે. તેને ઉકાળવા માટે ગેસ પર મુકી દેવામાં આવે છે. જ્યારે પાણી ઉકળવા લાગી જાય ત્યારે તેમાં લવિંગ નાંખી દેવામાં આવે છે. ત્યારબાદ તેને એ વખત સુધી ઉકાળવામાં

આવે છે જ્યાં સુધી લવિંગના રંગ પાણીમાં પૂર્ણ રીતે ન મળી જાય. હવે આ પાણીને ઠંડુ કરવામાં આવે છે. પાણી ઠંડુ થયા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. આ સ્થાનિક પ્રયોગનો ઉપયોગ કરીને ભેથીત્રણ દિવસમાં જ આના ફાયદા દેખાઈ આવે છે. દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે હાલમાં સામાન્ય લોકો શરદી ખાંસી અને ઉધરસને લઈને પરેશાન દેખાઈ રહ્યા છે. આના કારણે દહેશતમાં આવી જાય છે. જો કે આના કારણે દહેશતમાં રહેવા માટે કોઈ કારણ નથી. ઘરમાં રહેલી ચીજોનો ઉપયોગ કરીને આ બિમારીને દુર કરી શકાય છે. લવિંગ એમ પણ શરીર માટે અનેક રીતે ઉપયોગી રહે છે. હાલમાં શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારી દેવા માટેની બાબત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. તબીબો અને નિષ્ણાંતો કહે છે કે જે વ્યક્તિ રોગપ્રતિકારક ક્ષમતા પુરતા પ્રમાણમાં ધરાવે છે તેને કોઈ બિમારી લેવાની તક પકડી શકે તેમ નથી. સિઝનમાં ફેરફાર થવાની સાથે જ મોટા ભાગના લોકોને શરદી ગરમીની અસર થાય છે. જો કે હાલમાં તો તમામ લોકો ઘરમાં છે. કોરોનાના વાયરસના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિ વચ્ચે લોકો ઘરમાં છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને તો ઘરમાં પણ આ સિઝન શરદી ગરમીની અસર થઈ જાય છે. જેથી આ નાનકડી સમસ્યા માટે હાલમાં જટિલ સ્થિતિ વચ્ચે તબીબોની પાસે દોડી જવાની બાબત યોગ્ય નથી. ઘરમાં રસોડામાં રહેલી ચીજોનો ઉપયોગ કરીને આનો ઉપચાર કરી શકાય છે. આમાં વિલંબ થાય છે પરંતુ હાલમાં સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. લવિંગ અને પાણીનો ઉપયોગ નિષ્ણાંતના કહેવા મુજબ આદર્શ સાબિત થાય છે. અન્ય ઘરેલુ પ્રયોગ પણ રહેલા છે. જેનો ઉપયોગ કરીને શરદી ગરમી અને ઉધરસ જેવી સમાન્ય ફલુની તકલીફને ટાળી શકાય છે અને રાહત મેળવી શકાય છે.

ધર્મસ્થાનોની વ્યવસ્થાથી પ્રજાની ધાર્મિક તથા સામાજિક ચેતના માપી શકાય.

ફુંબનો મેળો...

હું જેવો જઈને ઊભો રહ્યો તેવા જ એક યજમાન મહાત્મા બહુ જ ભાવથી મને લેવા આવ્યા. અત્યંત ભાવથી આગ્રહ કરીને મને એક તરફ લઈ ગયા તથા સાડાં આસન બિછાવીને માનપૂર્વક બેસાડ્યો. મને નવાઈ લાગી. કશી જાણપિછાણ વિના આટલું બધું માન કેમ આપ્યું હશે? બધા જ સંતો કરતાં મને સાદા આસને બેસાડ્યો હોવાથી સંતોની નજર પણ મારા તરફ ખેંચાઈ. થોડી જ વારમાં મારી ચારે તરફ ભક્તસમુદાય બેસવા લાગ્યો તથા વારંવાર શરભત વગેરે પીવા માટે આગ્રહ થવા લાગ્યો. કશું સમજ્યા વિના હું પણ સ્થિતિને અનુકળ થઈ ગયો. મને થતું કે કદાચ મારા જેવા કોઈ તેમના પરિચિત સંત આવવાના હશે, આનિત્થી મને જ તે સમજી આવો ભાવ બતાવતા હશે. એક-બે વાર મેં તેમને કહ્યું પણ ખરું કે જેની તમે રાહ જુઓ છો તે હું નથી. હું તો બીજો છું. પણ તેમણે માન્યું નહિ. બસ 'આપ હી હૈ... આપ હી હૈ.' આવું બોલે. હું વૂપ થઈ ગયો. કલાક દોઢ કલાકમાં તો આખો ભક્ત સમુદાય મારા તરફ વળી ગયો. ખૂબ પ્રશ્નો અને સત્સંગ ચાલવા લાગ્યો. સૌનું લ-ય તથા ધ્યાન મારા તરફ વળી ગયું હતું. મને પણ ધર્મચર્ચા કરવામાં રસ પડતો હતો. એવામાં પેલા ડમરુવાળા મહાત્મા આવી પહોંચ્યા. આવતાં જ તેમણે જોરથી મારા કોઈ તેમના પરિચિત સંત આવવાના હશે, આનિત્થી મને જ તેમના તરફ ગયું. અમારી આંખો ચાર થઈ. તેમને લેવા કોઈ ગયું નહિ. તે અહીં નજીકના જ, સૌના પરિચિત હતા, એટલે તેમનું કોઈ માન ન હતું. બે-પાંચ પરિચિત બાવાઓને મળીને તેમણે જોયું કે મારી અહીં ખૂબ જ પ્રતિષ્ઠા થઈ રહી છે. એટલે તે પાસે આવ્યા. હું તેમનાથી છૂટવા માગતો હતો, પણ તે વધુ ને વધુ નજીક આવવા માગતા હતા. સાંજ ૫ થી, રાત્રી થઈ. આરતી થઈ અને પછી સૌ કોઈને ભંડારાની રસોઈ જમવા બેસાડ્યા. જમી રહ્યા પછી સૌની વ્યવહાર પ્રમાણે ભેટ-વિદાય થઈ. ભેટ-વિદાયમાં થોડો કલહ પણ થયો. લોકો એમ સમજતા હોય છે કે સાધુ થયા પછી માત્ર અધ્યાત્મ તથા પરમાર્થવૃત્તિ જ રહેતી હોય છે. પણ સાધુઓની પણ સંસારી માણસો જેવી જ દુનિયા હોય છે. કાકાગુરુ, દાદાગુરુ, ચાચાગુરુ, ગુરુભાઈ, ગુરુબહેન વગેરે સંબંધો તો ખરા જ. સાથે સાથે નાનામોટા મહંતો, અસ્થાનધારીઓ (સ્થાનધારીઓ) વગેરેની કક્ષાઓ અને કક્ષાઓ પ્રમાણે લેવડદેવડના વ્યવહારો પણ ખરા. આ વ્યવહારમાં ઘણી વાર લડાઈ-ઝઘડા તથા ખટપટો પણ થાય. 'વિદાઈ'નો અર્થ થાય છે કે નિશ્ચિત રકમ આપી દો,

પછી પેલા સાધુએ વિદાય થવું જોઈએ. પછી તેનાથી રહેવાય નહિ, અથવા સ્વયં વિદાય થતાં વિદાય-ભેટ મેળવે.

વિદાય-દિક્ષણા પૂરી થયા પછી જે નજીકના હતા તે બધા જ વીખરાવા લાગ્યા, જે દૂરના હતા તે ત્યાં જ મંડપ નીચે જ પોતપોતાના આસનિયા પાથરી સૂવાની વેતરણમાં પડ્યા. મારે તો વિદાય લેવાની ન હતી, કારણ કે હું પૈસાને સ્પર્શ કરતો નહિ. મને થયું કે હું પણ આ મંડપ નીચે જ સૌની માફક સુઈ જઈશ. પણ તેવામાં બે-ચાર ભક્તો આવીને કહેવા લાગ્યા કે- 'આપકે લિયે કમરેકી વ્યવસ્થા કી હૈ.' હું નુનાનજીના મંદિરથી અડધો માઈલ દૂર જ્યુટ મિલના મજૂરોની ચાલીઓ હતી. તેમાં એક રૂમ મારા માટે ખાલી કરાવીને તે લોકો મને લેવા માટે આવ્યા હતા. મારી અવી અકારણ પ્રતિષ્ઠા જોઈને પેલા ડમરુવાળા મહાત્માને નવાઈ લાગતી હતી. તેઓ મારી સાથે જ આવવા માગતા હતા. મને તે ઠીક લાગતું ન હતું. એટલે અંતે તેમને ત્યાં જ રહેવા દઈને હું ભક્તોની સાથે પેલા સ્થાને જવા નીકળ્યો. યજમાન સંત પણ સાથે હતા. મેં જોયું કે મારા માટે સુંદર રીતે સજાવેને રૂમ તૈયાર કરાવાયો છે. આખી ચાલીના ભક્તો મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. 'સદ્ગુરુદેવ કી જય'ના જયજયકાર સાથે સૌએ મને સત્કાર્યા.

મારા સંકોચનો પાર ન હતો. એક અજાણી વ્યક્તિ માટે આ લોકો આટલું બધું કેમ કરતા હશે? કાંઈ સમજાતું ન હતું. સૌના વીખરાઈ ગયા પછી હું અને પેલા યજમાન સંત બે જ રહી ગયા ત્યારે મારા પગમાં પડીને તેમણે મને ખૂબ નમસ્કાર કર્યા. મારો સંકોચ વધી ગયો. આ બધાને થયું છે શું? હું કાંઈ કરવું તો કોઈ કશું સાંભળતું નથી. અંતે પેલા મહાત્માએ કહ્યું, 'મને ગઈ રાત્રે સ્વપ્ન આપ્યું હતું તેમાં મારા ગુરુદેવે મને સૂચના આપી હતી કે તારા ભંડારામાં એક સાચા સંત આવશે જે આવા... આવા... હશે. તું તેમની ખૂબ સેવા કરજે. હું સવારથી જ પેલી નિશાનીઓ પ્રમાણેના સંતને ખોળતો રહ્યો. અંતે સાંજના સમયે તમે આવ્યા ને હું ધન્ય થઈ ગયો. મેં મારા સેવકોને પણ કહી રાખ્યું હતું કે એક સંત આવવાના છે. તેમની સેવા કરીને જીવન ધન્ય બનાવી લેજો.' તેઓની વાત સાંભળીને મને નવાઈ લાગી. હજી તો મેં દીક્ષા પણ લીધી ન હતી. કશું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું ન હતું. ત્યાં મને કોઈ દેવી રીતે સાચા સંતમાં ગોઠવી દેવાયો એથી એક તરફ તો મને બહુ જ સંકોચ થયો, તો બીજી તરફ પરમાત્મા પ્રત્યે અનન્યભાવ થયો.

આ ગામમાંથી મને બાર-પંદર દિવસ સુધી લોકોએ નીકળવા દીધો


ધમ્યુનિટી બુસ્ટર : અનેક પ્રકારની બિમારીઓ નજીક પણ નહીં આવે

રોજ સવારે માત્ર ચાર પિસ્તા ખાવો

સિઝનમાં ફેરફાર થયા બાદ કેટલાક લોકોને લોકડાઉનની સ્થિતિમાં પમ શરદી ગરમીની અસર થાય છે : તબીબ પાસે જવાનું હાલમાં ટાળો

ડ્રાય ફ્રુટ્સની વાત જ્યારે આવે છે ત્યારે તેમાં પિસ્તાનો ઉલ્લેખ ચોક્કસપણે કરવામાં આવે છે. આ એક એવા ડ્રાય ફ્રુટ્સ તરીકે હોય છે જે સરળ રીતે તમામને માર્કેટમાં ઉપલબ્ધ બને છે. તેના સ્વાદને લઈને પણ લોકોની વચ્ચે કેઝ રહે છે. અલબત્ત ખાદ્યામ, દ્રાક્ષ,કિશમિસ અને કાજુની તુલનામાં તેનો ઉપયોગ ડ્રાઈફ્રુટ ખાવામાં ઓછો કરવામાં આવે છે. છતાં તેના અસંખ્ય ફાયદા રહેલા છે. આજે અમે પિસ્તાના ફાયદાની વાત કરી રહ્યા છીએ. જાણકાર લોકો કહે છે કે તે આંખ માટે ખુબ ફાયદાકારક હોય છે. પિસ્તામાં વિટામિન એનુ પ્રમાણ હોય છે. તથા વિટામિન એ આંખના સંપૂર્ણ આરોગ્ય માટે એક સક્રિય વિટામિન તરીકે કાર્ય કરે છે. જેથી જો તમે આંખ સાથે સંબંધિત તકલીફથી દુર રહેવા માટે ઈચ્છો છો તો પિસ્તાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પિસ્તા કેન્સરની તકલીફને પણ ઓછી કરે છે. કેન્સર હવે એક એવી બિમારી બની ચુકી છે જેના કારણે દરવર્ષે લાખો લોકોના મોત થઈ જાય છે. એટલુ જ નહીં બલકે તેની સારવારમાં ઉપયોગ કરવામાં આવતી પ્રક્રિયા શરીરને ખુબ કમજોર બનાવી નાંખે છે. બીજી બાજુ પિસ્તામાં કેમો પ્રિવેન્ટિવ ગુણ રહેલા હોય છે. જે કેન્સરના જોખમને ઘટાડી દેવા માટે ઉપયોગી રહે છે. જેથી કેન્સર જેવી જીવલેણ બિમારીથી બચવા માટે ડાયટમાં પિસ્તાનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. હાર્ટ સાથે સંબંધિત બિમારીથી પણ રાહત મળે છે. આજે ભારતમાં કરોડો લોકો હાર્ટ સાથે સંબંધિત બિમારીથી પિડિત છે. આવા લોકો માટે ડ્રાય ફ્રુટ્સ તરીકે પિસ્તાનો ઉપયોગ ખુબ ફાયદો કરાવે છે.

પિસ્તામાં હકીકતમાં કાર્ડિયોપ્રોટેક્ટિવ એક્ટિવિટી જોવા મળે છે. જે હાર્ટ સાથે સંબંધિત રોગોથી બચાવી લેવામાં ભૂમિકા અદા કરે છે. હાર્ટ સંબંધિત રોગથી દુર રહેવા માટે પિસ્તાનો ઉપયોગ કરી શકાય છે. કોલેસ્ટ્રોલના લેવલને સંતુલિત રાખવામાં પણ પિસ્તાની ભૂમિકા રહેલી છે. પિસ્તામાં એવા ખાસ ગુણ હોય છે. જે કોલેસ્ટ્રોલના સંતુલનને જાળવી રાખવામાં ભૂમિકા અદા કરે છે. કોલેસ્ટ્રોલની સંતુલિત માત્રા આપને હાર્ટ સાથે સંબંધિત રોગોથી બચાવી લેવામાં ભૂમિકા અદા કરે છે. પિસ્તાના કારણે બ્રેઈન ફંક્શન એક્ટિવ રહે છે. પિસ્તામાં ન્યુરોપ્રોટેક્ટિવ એક્ટિવિટી જોવા મળે છે. તે દિમાગની કાર્યક્ષમતાને વધારી દે છે. તે દિમાગની કાર્યક્ષમતા માટે ઉપયોગી હોય છે. દરરોજ ચારથી પાંચ પિસ્તાનો જો ઉપયોગ કરવામાં આવે તો બ્રેઈન ફંક્શન યોગ્ય રીતે કામ કરે છે. એન્ડી ઈન્ફલેમેટરી કિષાથી ભરપુર હોવાના કારણે પિસ્તા શરીરમાં કોઈ પણ જગ્યાએ થતા સોજાને દુર કરવામાં ભૂમિકા અદા કરે છે. આ સોજા કેટલીક વખત ક્યારેય ક્યારેક કોશિકા તુટી જવાના કારણે અથવા તો કોઈ



ઈજાના કારણે થાય છે. આવી સ્થિતિને હાથ ધરવા માટે પિસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો ખુબ ફાયદો થાય છે. ડાયાબિટીસની સ્થિતિમાં પણ ફાયદો થાય છે. જે લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત છે તેમના માટે પિસ્તા ખુબ અસરકારક ડ્રાય ફ્રુટ્સ છે. પિસ્તામાં મેટાબોલિક કન્ડીશનને સુધારી દેવા માટે ગુણ રહેલા હોય છે. આ એક એવી સ્થિતિ હોય છે જેના કારણે ટાઈપ-૨ ડાયાબિટીસની સારવારમાં મદદ મળે છે. જેથી ડાયાબિટીસથી ગ્રસ્ત દર્દીઓ દરરોજ પિસ્તાનો ઉપયોગ કરી શકે છે. હાડકાને મજબુત કરવામાં પણ તેની ભૂમિકા રહેલી છે. હાડકાની રચના પર અમારા શરીરની રચના આધારિત રહે છે. તેમાં જો કમજોરી આવે છે તો શરીરની સ્થિતિ તેના કારણે બગડી શકે છે.

હાડકાને મજબુત કરવા અને તેને જાળવી રાખવા માટે પિસ્તા ઉપયોગી છે. પિસ્તામાં કેલ્શિયમનુ પ્રમાણ પણ રહેલુ છે. તમામ પ્રકારના ડ્રાય ફ્રુટ્સની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે તેમાં પિસ્તાનો ઉલ્લેખ ચોક્કસપણે કરવામાં આવે છે. તેમાંથી મિઠાઈઓનુ પણ નિર્માણ થાય છે. આધુનિક સમયમાં ડ્રાય ફ્રુટ્સની બોલબાલા વધી રહી છે. મોટા પ્રસંગે ડ્રાય ફ્રુટ્સની ભેટ આપવામાં આવે છે. જે શરીર માટે તમામ રીતે ઉપયોગી સાબિત થાય છે. પિસ્તાનો ઉપયોગ દરરોજ કરવાથી અનેક લાભ મળે છે.



સોનાલી બેન્દ્રેને કાળા કપડાં કેમ ગમે છે?

એવા ઘણા સેલેબ્રિટીઝ છે, જેઓ પાર્ટીઝ કે ઈવેન્ટ્સમાં બ્લેક ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. ઘણા લોકો એવું માને છે કે બ્લેક કપડાંમાં વ્યક્તિ વધુ પાતળી અને સ્લિમ દેખાય છે. તે ઘણા લોકો કેટલીક માન્યતાને કારણે પણ બ્લેક ડ્રેસ પહેરતા હોય છે. તાજેતરમાં સોનાલી બેન્દ્રેએ ખુલાસો કર્યો છે કે, તેને બ્લેક કપડાં પહેરવા ગમે છે. તાજેતરમાં સોનાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેણે એક એન્ડલ લેથનો બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે તેણે ગોલ્ડન ડ્રોપ ઈઅરિંગ્સ પહેરી હતી. સાથે બિલકુલ સાદગીભર્યાં હળવો મેક અપ કર્યો હતો. જ્યારે હેરસ્ટાઈલમાં એક બન બનાવ્યું હતું. આ તસવીરો સાથેની કેપ્શનમાં તેણે લખ્યું, “મારા કપડાંની જેમ, જેવી મને કોફી ગમે છે: બ્લેક!” ૧૨ નવેમ્બરે સોનાલી બેન્દ્રે અને તેના પતિ ગોલ્ડી બહલે ૨૨ મી એનિવર્સરી ઉજવી હતી. આ નિમિત્તે સોનાલીએ એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેમની રોમેન્ટિક યાદો તાજી કરી હતી. સોનાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો હતો. તેની સાથે કેપ્શનમાં તેણે લખ્યું, “૨૨ ગોલ્ડી બહલ”. આ કેપ્શન સરળ હતી, સાથે પોસ્ટ થયેલા વીડિયો તેમના સંબંધની મજબૂતી દર્શાવતો હતો. તેની સાથે તેણે દો પત્તી ફિલ્મનું “મૈયા” ગીત મુક્યું હતું. તેણે લખ્યું, “ત્યારે. હાલ. હંમેશા.” આ વીડિયોમાં એક તસવીર ૧૨ નવેમ્બર, ૨૦૦૨માં તેમના લગ્નની પણ હતી. સોનાલી અને ગોલ્ડીએ વેબવી લગ્ન કર્યાં હતા. જેમાં એ વખતના મુંબઈના મુખ્ય મંત્રી વસંતરાવ દેશમુખ સહીત ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. સોનાલીની કોઈ ફિલ્મ ઘણા વર્ષોથી જોવા મળી નથી, પરંતુ તાજેતરમાં તેની એક વેબ સિરીઝ આવી છે અને તે કેટલાક રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળે છે.

મનોજ બાજપાઈની ફિલ્મને ચૂકેનો બેસ્ટ ફિલ્મ એવોર્ડ

‘ધ ફેબલ’ને ૩૮મો લીડિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો એવોર્ડ

રાઈટર ડિરેક્ટર રામ રેડ્ડીની ફિલ્મ ‘ધ ફેબલ’ને ૩૮મા લીડિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪ની મેઈન ઇન્ટરનેશનલ કોમ્પિટીશનનો બેસ્ટ ફિલ્મ માટેનો એવોર્ડ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. કારણ કે આ એવોર્ડ જીતનારી આ પહેલી ભારતીય ફિલ્મ છે. ૧૯૮૭માં આ ફેસ્ટિવલ શરૂ થયો ત્યારથી કોઈ ભારતીય ફિલ્મ આ એવોર્ડ જીત્યો ન હોવાથી આ ભારતીય સિનેમા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ પહેલાં ‘ધ ફેબલ’નું બર્લિનેલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું, તેમજ મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ મળ્યું હતું.

આ અંગે ફિલ્મના ડિરેક્ટર રામ રેડ્ડીએ કહ્યું, “લીડિંગ એક પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલમાં પસંદ થયેલી ફિલ્મો તો અદ્ભુત હોય જ છે સાથે આ ફેસ્ટિવલને એકેડેમી એવોર્ડ માટેનો ક્વોલિફાઈંગ એવોર્ડ માનવામાં આવે છે, જેમાં આ વર્ષે ૨૫૦ સુંદર ફિલ્મો દર્શાવાઈ. મને આ વર્ષના ફેસ્ટિવલમાં ‘ધ ફેબલ’ રજૂ કરવાની તક મળી અને આ ફિલ્મને ઓડિયન્સનો જે પ્રતિસાદ મળ્યો તે જોરદાર હતો. તેનાથી અમારો ઉત્સાહ ઘણો વધ્યો. આ રીતે આ પ્રકારના ફેસ્ટિવલમાં અમને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળવો એ એક ફિલ્મ મેકર તરીકે હું આભારી અને સંતોષની લાગણી અનુભવું છું. હું આ એવોર્ડ અમારી સમગ્ર ટીમને સમર્પિત કરવા માંગું છું, જેમના વર્ષોના પ્રયત્નો અને મહેનતથી આ ફિલ્મ

જવંત બની.” આ ફિલ્મના લીડ એક્ટર મનોજ બાજપાઈએ જણાવ્યું, “આ ફિલ્મનો ભાગ બનીને હું અતિશય ગૌરવ અનુભવું છું કે આ ફિલ્મ વિશ્વકથાએ લોકોને સ્પર્ષી શકે છે. પ્રતાપ રેડ્ડી અને રામ રેડ્ડી સાથે જુદી અગ્રવાલ, ગુનિત મોંગા તેમજ અચિન જેનની વાર્તા કહેવાની રીત અને વાસ્તવિકતાને જાદુઈ રીતે ઊંડાણ ઉમેરવાની શૈલીથી મને અનોખો અનુભવ પ્રાપ્ત થયો છે. મારી સાથે પ્રિયંકા બોઝાસ દીપક ડોબરિયાલ અને તિલોત્તમા શોમેએ પણ અદ્ભુત કામ કર્યું છે. આ માત્ર અમારી ફિલ્મની જીત નહીં પણ ભારતીય સિનેમાની એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. આશા છે કે આ ફિલ્મ લોકોને પ્રેરિત કરતી રહે અને સ્પર્ષતી રહે.” ગુનીત મોંગાએ આ અંગે જણાવ્યું હતું, “આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો તેનાથી હું અતિ ઉત્સાહીત છું. આ ભારતીય સિનેમાની પહેલી જીત છે. રામ રેડ્ડીની દૃષ્ટિ અને મનોજ બાજપાઈના અભિનયનું આ પરિણામ છે. લોકો આ ફિલ્મ સાથે જોડાઈ શકે છે તે અમારા માટે ગૌરવની વાત છે.”



આ એક ઈન્ડિયન-યૂએસના પ્રોડક્શનની સહિયારી ફિલ્મ છે. જેમાં ઓસ્કાર એન્ટેટમાં કામ કરતા શાંત

આ અંગે ફિલ્મના ડિરેક્ટર રામ રેડ્ડીએ કહ્યું, “લીડિંગ એક પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલમાં પસંદ થયેલી ફિલ્મો તો અદ્ભુત હોય જ છે સાથે આ ફેસ્ટિવલને એકેડેમી એવોર્ડ માટેનો ક્વોલિફાઈંગ એવોર્ડ માનવામાં આવે છે,



પુશી કપૂરે વેદાંગ રૈના સાથે સંબંધોની અફવા અંગે ખુલાસો કર્યો

પુશી કપૂર અને વેદાંગ રૈના ડેટ કરતા હોવાની અફવાઓ ઘણા લાંબા સમયથી ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પુશીને પૂછ્યું હતું કે તે એક એક્ટર તરીકે પોતાની ડેટિંગ અંગેની અફવાઓનો સામનો કઈ રીતે કરે છે. આ પ્રશ્નના જવાબમાં પુશીએ કહ્યું, “મારા માટે આ બધું ચોક્કસ નવું છે અને આ અંગે મેં પહેલાં ક્યારેય ખાસ વિચાર્યું પણ નથી. એટલે હું ઈન્ફોર્મલ છે હું મારા કામ પર જ વધારે ધ્યાન આપું. હું સમજું છું કે તમે જ્યારે જાહેરમાં લોકોના ધ્યાનમાં હોય ત્યારે તમારા વિશે કેટલીક ઉત્સુકતા હોય છે, પરંતુ મને લાગે છે કે તમે તમારા અંગત જીવનને અંગત જ રાખો અને કામને જ પ્રાથમિકતા આપો એ શ્રેષ્ઠ ઉપાય છે.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે જરૂર પડે ત્યારે પરિવારમાં કોની સલાહ લેવા જાય છે, ત્યારે પુશીએ કહ્યું, “હું જહાન્વી પાસે, ડેડી કે અર્બુન ભાઈ પાસે જતી હોઉં છું. એમની પાસે મારા કરતાં ઘણા વર્ષોનો અનુભવ છે.”

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે જરૂર પડે ત્યારે પરિવારમાં કોની સલાહ લેવા જાય છે, ત્યારે પુશીએ કહ્યું, “હું જહાન્વી પાસે, ડેડી કે અર્બુન ભાઈ પાસે જતી હોઉં છું. એમની પાસે મારા કરતાં ઘણા વર્ષોનો અનુભવ છે.

સેન્સર બોર્ડે ‘ધ સાબરમતી રિપોર્ટ’ના ૪૦ ટકા હિંસાત્મક સીન પર કાતર ચલાવી દિધી કેટલાંક વાંધાજનક ડાયલોગ દૂર કરીને ચૂએ સર્ટિફિકેટ આપ્યું

ગોધરા કાંડ અને તેના પર રજૂ થયેલા મીડિયાના અહેવાલો પર આધારીત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ને સેન્સર બોર્ડે ચૂએ સર્ટિફિકેટ આપ્યું છે. સેન્સર બોર્ડના સૂચન અનુસાર ફિલ્મની ટીમે લગભગ ૧૧ ફેરફાર કર્યાં છે, જેમાં ફિલ્મમાંથી ૪૦ ટકા હિંસાત્મક દૃશ્યો દૂર કરાયા છે અને કેટલાંક વાંધાજનક ડાયલોગ પણ દૂર કરાયા છે. જેમકે એક ડ્રાઈવરનો ડાયલોગ, “સબ મિલતા હૈ, બ્રાન્ડ બતાઈયે” ને બદલી દેવાયું છે અને અશ્વ કુમારની આરોગ્યલક્ષી જાહેરખબરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં ગોધરા કાંડનું રિપોર્ટિંગ કરી રહેલા પત્રકારનો રોલ વિકાંત મેસ્સી કરી રહ્યો છે, તેની સાથે રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ પત્રકારનો રોલ ભજવે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાંક વલણ બીજેપી તરફ થોડું હળવું થઈ લોકોનો એવો દાવો છે કે આવનારી ફિલ્મના કારણે વિકાંત મેસ્સીનું સોશિયલ મીડિયા પર કેટલાંક વલણ બીજેપી તરફ થોડું હળવું થઈ ગયું છે. આ ચર્ચાઓ અંગે જવાબ આપતાં વિકાંત મેસ્સીએ જણાવ્યું હતું કે વર્ષોના તેના અંગત અનુભવોને કારણે તેના વિચારો પણ બદલાયા છે. તેનું કારણ માત્ર પ્રોફેશનલ નથી. તાજેતરમાં એક પોડકાસ્ટમાં વિકાંતે કહ્યું હતું કે તે માના છે કે પરિવર્તન અનિવાર્ય છે, પરંતુ તેના દરિદ્રકાળમાં ફેરફાર થયો હોવા છતાં તે પોતાની બિનસાંપ્રદાયિક વિચારધારાને વરેલો છે. વિકાંતે કહ્યું કે સમગ્ર ભારતના પ્રવાસ અને વિવિધ પરિપ્રેક્ષ્યમાંથી આવતા લોકો સાથેની મુલાકાતોને કારણે તેનું વલણ બદલાયું છે. તે લોકો સાથે વાતો કરવાથી તેમની સમસ્યાઓને વધુ સ્પષ્ટતાથી સમજી શકે છે. વાસ્તવિકતાના અનુભવ સાથે તેની સમજમાં ઊંડાણ આવ્યું છે. હવે તે કોઈ પણ સમસ્યાને તટસ્થ રીતે જોઈ શકે છે. મન શાંત રાખીને તેમાંથી બહારના પ્રભાવને અલગ તારવી શકે છે.



‘ડોન ૩’માં રણવીરનો મુકાબલો કરવા મેસ્સીને ઓફર વિકાંતે અગાઉ ‘સેક્ટર ૩૬’માં મનોવિકૃત કિલરનો રોલ કર્યો હતો

શાહરૂખ ખાનના વારસદાર તરીકે ‘ડોન ૩’માં રણવીર સિંહની પસંદગી થયેલી છે. ડાયરેક્ટર ફરહાન અખ્તર અને રણવીર સિંહ લાંબા સમયથી આ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે. ‘ડોન ૩’માં જૂની કાસ્ટને રીપિટ કરવાના બદલે નવી પેઢીને તક આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. રણવીરના ઓનસ્ક્રિન મુકાબલા માટે વિલન તરીકે એક નામો પર વિચારણા બાદ વિકાંત મેસ્સીની પસંદગી થયેલી છે. વિકાંતને આ રોલ ઓફર થયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ વિકાંતે જુઓ આ ફિલ્મ સાઈન કરી નથી. વિકાંત મેસ્સીની કરિયરમાં અત્યાર સુધીની ઉત્તમ ફિલ્મ તરીકે ‘૧૨વી ફેલ’ની ગણતરી થાય છે. આ ફિલ્મની સફળતા બાદ વિકાંતને ટગલાબંધ ઓફર મળી રહી છે. વિકાંતની ટેલેન્ટનો પરચો જોવા પછી તેને



‘ડોન ૩’માં મુખ્ય વિલનનો રોલ ઓફર થયો હોવાનું ચર્ચાઈ છે. વિકાંત અને ફરહાન અખ્તર તરફથી આ અંગે કોઈ ખુલાસો થયો નથી, પરંતુ વિલન તરીકે વિકાંતે પોતાના કાર્બલિયત પુરવાર કરેલી છે. અગાઉ ‘સેક્ટર ૩૬’માં વિકાંતે મનોવિકૃત કિલરનો રોલ કર્યો હતો. ઓડિયન્સ અને ક્રિટિક્સને વિકાંતનો રોલ પસંદ આવ્યો હતો, પરંતુ તે સમયે વિકાંતની ખાસ ચર્ચા થઈ ન હતી. વિકાંતની આગામી ફિલ્મ સાબરમતી રિપોર્ટ આવી રહી છે. જેમાં તેની સાથે રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં છે. વિકાંતની આ ફિલ્મની રિલીઝ સાથે જ વિવાદો શરૂ થવાની સંભાવના છે અને આ ફિલ્મના કારણે પોતાને ધમકીઓ મળતી હોવાનું પણ વિકાંતે સ્વીકારેલું છે. વિકાંતની આ ફિલ્મની સફળતા માટે રાહ જોવા વગર ફરહાને તેને ‘ડોન ૩’માં વિલન બનવા ઓફર આપી છે. વિકાંત પોતે આ ઓફરથી ખૂબ ખુશ હોવાનું મનાય છે.



કાર્તિક અને વિધાની હોરર કોમેડીની OTTના દર્શકોએ વધારે રાહ જોવી પડશે

દિવાળી પર ૧ નવેમ્બરે ‘સિંધમ અગેઈન’ની સાથે થિએટરમાં ‘મુલભુલૈયા ૩’ રિલીઝ થઈ હતી. કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તુમિ ડિમરી અને માધુરી દિક્ષિતની આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. છતાં બોક્સ ઓફિસ પર ફિલ્મને અત્યાર સુધીમાં ભારતમાં લગભગ ૧.૮૩ કરોડ જેટલી અને વર્લ્ડ વાઈડ ૨૬૨ કરોડની કમાણી થઈ ચૂકી છે. પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ ફિલ્મની ઓટીટી પર આવવાની રાહ જોઈને બેઠેલા દર્શકોને થોડી વધુ રાહ જોવી પડશે. સામાન્ય રીતે થિએટરમાં રિલીઝ થયાના સાત કે આઠ મહવારિયા પછી ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે. પરંતુ કેટલાંક અહેવાલો મુજબ અનીસ બાઝમીની આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૫ પહેલાં ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં. ફિલ્મ દિવાળીના તહેવારો પર રિલીઝ થઈ પછી પહેલાં જ અઠવારિયે ૧૫૦ કરોડની કમાણી કરી લીધી હતી. સામે સિંધમ અગેઈન પણ ધૂમ મચાવી રહી હતી, છતાં આ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું. હાલ આ ફિલ્મે સૌથી વધુ કમાણીમાં વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ચોથું સ્થાન મેળવી લીધું છે.

સુરત ગ્રામ્યમાં માર્ગ અકસ્માત: ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં

અલગ-અલગ ઘટના

સંદર્ભે પોલીસ ફરિયાદ

પ્રતાપ પ્રતિનિધિ સુરત, તા. ૧૮ સુરત જિલ્લાના માંડવી, પલસાણા અને કોસંબા પાસે રોડકાલે અકસ્માતના ચાર અલગ-અલગ બનાવમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત સર્જનારા વાહન ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગ્રામ વિગત અનુસાર માંડવીના લીમથી ગામના બસ સ્ટેશનની સામેથી પોતાની કાર બેકામ રીતે હંકારી લાવી બાઈક ઉપર જઈ રહેલા કરમસિંહ વસાવા ઉ.વ.૫૦ને ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું હતું.

મીઠાઈની દુકાનમાં આગ ચાંપનાર

ત્રણ બાળકોના શરતી જામીન મંજૂર બાળકિશોરોને

જુવેનાઈલ સ્કુલમાં મોકલવાના રહેશે

પ્રતાપ પ્રતિનિધિ સુરત, તા. ૧૮ ભટાર ખાતે મીઠાઈની દુકાનમાં આગ ચાંપવાના પ્રકરણમાં ત્રણ બાળ કિશોરને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે સ્કુલમાં મોકલવાની શરતો સાથે જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવ્યો હતો. એડવોકેટ વિવુલ શુક્લાએ દલીલો કરી હતી.

મુળ રાજસ્થાનનો વતની અને હાલ ગોડાદરા દેવી કૃષા સોસાયટીમાં રહેતો પંકજ બપ્તારસિંગ રાજપ

હતું. “અકસ્માતના બીજા બનાવમાં પલસાણા તાલુકાના તાતીઝધડા ગામની સીમ પાસે હાઈવે નં. ૪૮ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન કાનલતબરી રીતે હંકારી લાવી કાનલ નરસંગભાઈ ચૌધરી (ઉ.વ. ૬૩)ને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાને પગલે કાનજીભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું. “આ ઉપરાંત કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં પણ અકસ્માત થયો હતો. જેમાં કોસંબાના વેલાછા ગામની સીમમાં નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર લઈને જતા ચાલકે વરાછા ચીકુવાડી સુરભી સોસાયટીમાં રહેતા પ્રવિજ જાદવભાઈ બલર (ઉ.વ. ૫૧) તેમની મોટર સાઈકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેમને ટક્કર મારી હતી. માથામાં ગંભીર

ઈજાને પગલે પ્રવિજાભાઈ પણ મોતને ભેટ્યા હતા. અન્ય એક અકસ્માતમાં કામરેજ અબ્રામા રોડ ઉપર એક અશોક લેલન કંપનીના હાઈવા ડમ્પર નં. જીજે. ૧૩. એ ડબલ્યુ ૯૭૬૬ના ચાલકે બેફિકરાઈથી હાઈવા ટ્રેક હંકારી લાવી બાઈક ઉપર જઈ રહેલા ધનરાજ કાતરીયા (ઉ.વ. ૨૪)ને અડફેટે લીધો હતો. ધનરાજને પાછળથી હાઈવા ચાલકે ટક્કર મારતા પાછળ બેસેલા દયાબેન લાડુમોર અને તેના પુત્ર કિર્તન લાડુમોર (ઉ.વ. ૧૫)ને ગંભીર ઈજા પહોંચી હતી. જે પૈકી ધનરાજ કાતરીયા અને દયાબેન લાડુમોરનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે હાઈવા ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

રોહિત ભટાર ખાતે બાલાજી સ્વિટ્સ નામે દુકાન ચલાવે છે. ગત.તા.૪ નવેમ્બરે ગઢુ નામનો યુવક પંકજની દુકાને આવી સામાનની ખરીદી કરી હતી. અલગ-અલગ સમયે આવીને ગઢુએ પંકજની દુકાનથી છુટકા-છુટકા કુલ રૂ. ૫ હજારથી વધુના સામાનની ખરીદી કરી હતી અને પેમેન્ટ મોબાઈલ પરથી ઓનલાઈન ક્યુઆર કોડથી પૈસા ટ્રાન્સફર માર્યા હતા. પરંતુ ગઢુના મોબાઈલમાં જ નાણાં ટ્રાન્સફર થયા હોવાનું બતાવતું હતું. ખરેખર નાણાં ટ્રાન્સફર થયા ન હતા. ગઢુએ ચિટીંગ કરી હતી. આ બાબતે પંકજ અને તેના ભાઈ બજરંગે ગઢુ પાસે

પૈસાની માગણી કરતા તેને ઠગડો કર્યો હતો. બાદમાં ગઢુએ ત્રણ સગીર બાળ કિશોરોનો ઉપયોગ કરી તેમની પાસે પંકજની દુકાને આગ લગાવી દીધી હતી. આ અંગે પંકજે ખતોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ખતોદરા પોલીસે ૧૪ વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધીના ત્રણ બાળ કિશોરને રિટેઈન કર્યા હતા. ત્રણેય બાળ કિશોરે વકીલ વિવુલ શુક્લા મારફતે જુવેનાઈલ બોર્ડમાં જામીન અરજ કરી હતી. જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે ત્રણે બાળ કિશોરને સ્કુલમાં મોકલવાની હિદાયત સાથે શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા.

ગ્રેજ્યુએશન બાદ કરાશે. છાત્ર હવે માસ્ટર પ્રોગ્રામમાં સરળતાથી બીજી સ્ટ્રીમમાં જઈ શકશે. જૂની ધરેડને બદલવાની શરૂઆત: હવે યુનિવર્સિટીઓ ઈચ્છવા છતાં પણ જૂની ઘરડૂ પર નહી ચાલી શકે. કારણકે સ્પર્ધાના આ દોરમાં છાત્રોને જ્યાં વધુ તક મળશે, તે યુનિવર્સિટીઝની ઉચ્ચત વધશે.

સરકાર દ્વારા

પહેલા પાનાનું ચાલુ

હતો તે ઘટાડવામાં સફળતા મળી છે છતાં પણ ૨૮% બગાડ કે ખરેખર જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તે એક મોટો મુદ્દો છે. સરકાર પેટાકા ઉંચા ભાવે આ અનાજ ટેકાઈને છે અને જરૂરિયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પુરુ પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડીજીટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈમ્વેસન સહિતના ઉપાયો કર્યાં છતાં પણ રૂા. ૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું નથી. જો કે રસપેટા બાબત એ છે કે આ પ્રકારે જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવા વા છે. પશ્ચિમ બંગાળે બિહાર એ મોટી સફળતા મેળવે છે. મહારાષ્ટ્રમાં આ બગાડનું પ્રમાણ ૬૮.૭% માંથી મહીને ૧૯.૨% પહોંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં તો ૬૯.૪% હતો તે ઘટીને ૯% થયો છે.

ઉત્તરપ્રદેશમાં પીડીએસ લીકેજ ૩૩% જેવું હતું. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં પણ લીકેજનું પ્રમાણ ઉચ્ચ રહ્યું છે. જે રાજ્યોએ આધાર-રાશનકાર્ડ લીંક કરાવવામાં સફળતા મેળવી છે અને જેઓએ ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમમાં પણ સુધારા થયા છે ત્યાં આ બગાડ અટક્યો છે.

ન્યુગોર્ક

પહેલા પાનાનું ચાલુ આ એકમાત્ર એવો કિસ્સો છે કે જેમાં આવી સંભવિત અથડામણને લઈને ફ્લાઈટની સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેન એક વસ્તુના નજીકથી સંપર્કમાં આવ્યું હતું જે આકારમાં નવાકાર દેખાતું હતું. આ યું હતું તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિપોર્ટમાં કુલ ૭૫૭ અજાણી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી લગભગ ૩૦૦ ઘટનાઓનો પુલાસો કરવામાં આવ્યો છે. ઘણી અજાણી વસ્તુઓને કુગળા, પક્ષીઓ, વિમાન, ડ્રોન અથવા ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવી છે. એવી ૨૭૨ ઘટનાઓ હતી જે અગાઉ નોંધવામાં આવી ન હતી, પરંતુ ૧ મે, ૨૦૨૩ અને ૧ જૂન, ૨૦૨૪ વચ્ચે નોંધવામાં આવી હતી. નક્કર માહિતીનો અભાવ હોવાથી અન્ય કઈય ઘટનાઓ સમજાવી શકાઈ નથી. સાક્ષીઓએ વારંવાર ગોળાકાર, ગોળા જેવી

અથવા ચમકતી વસ્તુઓ જોવાની જાણ કરી હતી. એક વ્યક્તિએ ફ્લાઈટ દરમિયાન “ફ્લેશિંગ લાઈટ્સ સાથે જેલિફિશ આકારની વસ્તુ” જોઈ હોવાનો દાવો કર્યો હતો. AAROએ જણાવ્યું હતું કે લોકો ઘણી વખત એલેન મસ્કની સ્પાર્ટલિક સેટેલાઈટ ચેઈનને UFOs સમજાવવાની ભૂલ કરે છે. રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે “અત્યાર સુધી છછઈને એલિયન એક્ટિવિટી, ટેકનોલોજી કે જીવનના કોઈ પુરાવા મળ્યા નથી.”

ગાઠ ધુમ્મસ

પહેલા પાનાનું ચાલુ એ મ કહેવાયુ છે કે, આનંદવિહાર, ઓખલા, પુસા જેવા કેટલાક વિસ્તારોમાં તો પ્રદુષણ ઈન્ડેક્સ ૬૦૦ને પણ પાર થઈ ગયો હતો. કચેરીઓમાં પણ ૫૦ ટકા ક્ષતમાં કાર્ય છતાં મુખ્ય કરવા તથા બાકીનાને વર્કફોમ હોમ કામગીરી કરાવવાની સૂચના આપવામાં આવી છે.

દિલ્હીના

પહેલા પાનાનું ચાલુ કચરાનું વ્યવસ્થાપન અને પરાલી સળગાવવા જેવા મુદ્દાઓને આવી રી છે.

અહીં, દિલ્હીમાં વધતા પ્રદુષણને કારણે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ચોથા તબક્કાનો અમલ કર્યો છે. તેના નિયમો સવારે ૮ વાગ્યાથી લાગુ થયો છે.

સીધા કરવેરાની

પહેલા પાનાનું ચાલુ દેશના વ્યાપારી પાટનગર તરીકે જાણીતા મુંબઈમાં સૌથી વધુ રૂા.૯૬ લાખ કરોડની ટેક્ષ બાકી બાદ બીજા ક્રમે દિલ્હી રૂા.૪.૯ લાખ કરોડ, ગુજરાત રૂા. ૧.૮ લાખ કરોડ, તામિલનાડુ રૂા. ૧.૪ લાખ કરોડ, કર્ણાટક અને ગોવા રૂા. ૧.૧ લાખ કરોડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રૂા. ૧ લાખ કરોડ અને ઉત્તરપ્રદેશ પુર્વમાં રૂા. ૧ લાખ કરોડની વસુલાત બાકી છે. આ બાકીમાં ટોચના ૫૦૦૦ કેસોમાંજ ૬૦% જેટલી રકમ ફસાઈ છે.

આ કેસમાં જેમની વસુલાત ખુબજ મુશ્કેલ કે શક્યતા જ નથી તેને અલગ પાડવા જણાવાયુ છે અને તેના આધારે દરેક ઝોનને પાસ ટીમ બનાવીને પ્રીન્સીપલ કમિશ્નર અોક ઈન્ડમટેક્ષના નેતૃત્વમાં આ ૫૦૦૦ કેસોમાં વસુલાત ઝડપી બનાવવા જણાવાયું છે.

આ ઉપરાંત ૧૦ વર્ષ કે તેથી જૂની વસુલાતમાં જ્યાં કરદાતા મૃત્યુ પામ્યા હોય કે ‘ગુમ’ થયે તેની યાદી તૈયાર કરીને તે રકમ માંડવાળ કરવા પણ તૈયારી છે.

લવેશી

પહેલા પાનાનું ચાલુ

સાઈબર છેતરપીંડીનો ભોગ બનતા ગ્રાહકો માટે ૧૯૩૦

પ્રતાપ દર્પણ

રાજહંસ હોટલ બેલિઝામાં રોકાયેલા મુસાફરનું હાર્ટ એટેકથી મોત લેફ્ટમાં ઉતરતી વેળા રાજકોટના અમિતભાઈનું મૃત્યુ

પ્રતાપ પ્રતિનિધિ સુરત, તા. ૧૮

રાજકોટથી સુરત કામ અર્થે સુરત આવેલા વેપારી રાજહંસ હોટલ બેલિઝાની લેફ્ટમાંથી નીચે ઉતરતી વખતે અચાનક બેભાન થઈ જતાં મૂત જાહેર કર્યા હતા. જ્યાં રાજકોટના માવડી ખાતે પીડવેલ પાર્ટી પ્લોટની નજીક આયલિન્ડ રેસીડેન્સીમાં અમિત

જયસુખભાઈ(૫૦) રહેતા હતા. અમિતભાઈ કામ અર્થે સુરત આવ્યા હતા. તેઓ ડુમસ રોડની રાજહંસ હોટલ બેલિઝામાં રોકાયા હતા. ગત સાંજે હોટલની લેફ્ટમાં અમિતભાઈ નીચે ઉતરી રહ્યા હતા. તે સમયે અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક તેમના ભાઈ મિતેશ કલ્યાણી ખાનગી સ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે તેમને મૂત જાહેર કર્યા હતા. મૂતકને હાર્ટ એટેકની શક્યતા લાગી રહી છે.

કામરેજના વધુ એક શેરડીનાં ખેતરમાં આગ

પ્રતાપ પ્રતિનિધિ સુરત, તા. ૧૮

સુરત જિલ્લાના શેરડીના ખેતરોમાં વિતેલા ત્રણ દિવસથી શંકાસ્પદ રીતે ખેતરોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. શેરડીના ખેતરોમાં જ મોટે ભાગે આગ લાગી રહી હોય અજે વધુ એક બનાવ બન્યો છે. કામરેજ ગામ નજીક આજે સવારે વધુ એક ખેતરમાં આગ લાગી હતી. અંદાજે ત્રણથી સવા ત્રણ વિઘા જમીનમાં લાગેલી આગને કારણે શેરડીનો પાક બળીને રાખ થઈ ગયો હતો. ખેતરને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. “મળતી વિગત મુજબ કામરેજ

તાલુકાના કેટલાક ગામોમાં માત્રના માત્ર શેરડીના જ ખેતરમાં વિતેલા ત્રણ દિવસથી આગ લાગવાના બનાવ બની રહ્યા છે. જે શંકા ઉપજાવે તેવી ઘટના હોવાની ચર્ચા ચાલી રહી છે. આજે સવારે પણ એક ખેતરમાં આગ લાગતા ફાયરના લાશ્કરોએ સ્થળ ઉપર પહોંચી શેરડીના ખેતરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાળુમાં લીધી હતી. શેરડીના બે થી અઢી વિઘા ખેતરોમાં શેરડીના પાકને આગથી નુકશાન થતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેતર આગ લાગી રહ્યું છે કે અકસ્માતે આવા બનાવ બની રહ્યા છે તે અનેક શંકા ઉભી કરી રહ્યું છે.

નંબરનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સાઈબર છેતરપીંડીથી બચવા માટે લોકોને સાવચેત રહેવા રિઝર્વ બેન્ક જોર આપી જ રહી

છે. બોગસ ઈમેલ-મેસેજ, ક્યુઆર કોડની ઠગાઈ, સોશયલ એન્જનીયરીંગ થી પુરસ્કાર વગેરે મારફત ઠગાઈ જેવા કિસ્સાઓને રોકવા માટે વિવિધ સલાહ આપી રહી છે.

ફોનનો સોફ્ટવેર નિયમિત અપડેટ રાખવા, પિન-પાસવર્ડ અજાણ્યા લોકોને ન આપવા, પાસવર્ડ જટીલ રાખવા, મલ્ટી ફેક્ટર, ઓથેન્ટિકેશન રાખવા દરેક વખતે યુપીઆઈ એપનો ઉપયોગ ન કરવા વગેરે સુચનો કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના

પહેલા પાનાનું ચાલુ માટે ચૂંટણી પંચની પરવાનગી નથી. અગાઉ, પોલીસે મુંબઈમાં વાશી ચેમ્પોસ્ટ પાસે એક ટ્રકમાંથી ૮,૪૭૬ કિલો ચાંદી જમ કરી હતી, જેની અંદાજિત રકમ ૮૦ કરોડ રૂપિયા હતી.

બરગોધનમાં બે

પહેલા પાનાનું ચાલુ સંગઠન મહામંત્રી કિશન પટેલ, ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખ બિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત કારોબારી અચ્યજ જયેશભાઈ પટેલ, અગ્રણી સુનિભભાઈ પટેલ, જીનેશભાઈ પટેલ, સુરત નેચરલ કલબનાં સભ્યો, એસ. બી. આઈ બેંકનાં કર્મચારીઓ, બરગોધન ગ્રામજનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતાં

કોચલી બાકી પર

પેજ-૨ પાનાનું ચાલુ આરોગ્ય પર ગંભીર અસરો થતી હોવાથી આ ખાંડીને કવર કરીને બોક્ષ ડ્રેઈન બનાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવા પાલિકાના સંલગ્ન વિસ્તારના સુંટાચેલ કોર્પોરેટરો સહિત સંકળાયેલ વિવિધ વિભાગોની અધિકારીઓની તાકીદે સંયુક્ત સંકલન બેઠક દિન-૭ માં બોલાવી બાકી રહેલ કામગીરી અંગે જવાબદાર અધિકારીશ્રીઓ પાસે જરૂરી પુલાસા મેળવી સભા સમક્ષ રજુ કરવા જણાવેલ તેમજ બાકી રહેલ કામગીરીને નિયત સમયમર્યાદામાં પુર્ણ કરવા જરૂરી આયોજન કરવા અને જરૂરી સુચના આપી ઝડપભેર ખાંડી કવર કરી બોક્ષ ડ્રેઈનની અટકી પડેલી કામગીરી પુર્ણ કરાવવા મ્યુનિ. કમિશ્નરને રાજીઆત કરી હતી.

વીર નર્મદ

પેજ-૨ પાનાનું ચાલુ સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટીડીઝના નોડલ અધિકારી ડો. મનીષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વહીવટી વિભાગના વડાશ્રીઓ, યુનિવર્સિટીના પ્રધ્યાપકો તથા વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જમીન સંપાદનની

પેજ-૨ પાનાનું ચાલુ પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલે સુરત જિલ્લામાંથી પસાર થતા એક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે જમીનો સંપાદિત થયેલ છે જેમાં અમુક ખેડૂતોને વળતર

લાંબો સમય જળમગ્ન રહેલા કોમ-વેના આરસીસી સ્ટ્રક્ચરને ગંભીર નુકશાન

કામ-વેના સમારકામમાં રૂ. ૧૭.૮૮ કરોડનો ખર્ચ

પાણીમાં ઘોવાઈ ગયો

પ્રતાપ પ્રતિનિધિ સુરત, તા. ૧૮ લાંબો સમય જળમગ્ન રહેલા કોમ-વેના આરસીસી સ્ટ્રક્ચરને ગંભીર નુકશાન “કોમ-વેના સમારકામમાં રૂ. ૧૭.૮૬ કરોડનો ખર્ચ પાણીમાં ઘોવાઈ ગયો” સુરત, તા. ૧૮ “સુરત શહેરના રોંદેર અને કતારગામને જોડતો વીયર કમ કોમ-વે હાલ ઉપરવાસથી આવતા પાણીને કારણે આમજનતાનાં પરિવહન માટે બંધ છે. ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે તંત્ર દ્વારા વીયર કમ કોમ-વેની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. અને ટુંક સમયમાં તેને વાહન વ્યવહાર માટે ખોલવામાં આવશે. તેવા સમયે આ વીયર કમ કોમ-વેને સમાંતર બનાવવામાં આવેલા આરસીસી સ્ટ્રક્ચરના હાડખીજાર

પાણી ઓસરતા હવે દેખાવા લાગ્યા છે. ત્યારે મનપાની આ કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાનું અને તેમાં પણ ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું જણાઈ રહ્યું છે. “શહેરનો વીયર કમ કોમ-વેની સુરક્ષા માટે તંત્ર દ્વારા અપ સ્ટ્રીમ અને ડાઉન સ્ટ્રીમમાં બે એપ્રોન સમાંતર રીતે બનાવવામાં આવ્યા હતા. આ એપ્રોન બનાવવા પાછળ ૧૭.૮૬ કરોડ જેવી માતબર રકમનો ખર્ચ થયો છે ત્યારે પાણી ઓસર્પા બાદ આ એપ્રોનની જે સ્થિતિ જોવા મળી રહી છે. તે જોતા ભ્રષ્ટાચારનાં ભોરીંગ ફરીથી ઉખડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ સ્ટ્રક્ચરમાં ગાબડા પડી ગયા છે અને લોખંડના સળીયા દેખાવા લાગ્યા છે. ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ પણ ઉપરવાસના પાણીમાં ઘોવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. “અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, સીમેન્ટ કોંક્રીટના બનાવેલા રોડ પણ

વધુ લાંબો સમય ટકી રહેતા હોય છે ત્યારે કોમ-વેને સમાંતર બનાવવામાં આવેલા આ બંને એપ્રોન કે જે આરસીસી સ્ટ્રક્ચરના બનેલા છે તેની અવદશા ઘણા સવાલો ઉભા કરી રહી છે. ચોમાસુ પુરૂ થાય ઉભા મળે છે ત્યારે કોન્ટ્રાક્ટરો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેદરકારી છતી થઈ રહી છે. કરોડોના ખર્ચે બાદ પણ આરસીસી સ્ટ્રક્ચરમાં દેખાતા સળીયા અધિકારીઓની મિલીભગત હોવાના અનેક સવાલો ઉભા કરી રહી છે. હવે તંત્ર દ્વારા ફરીથી આ કામગીરી માટે કરોડોને ટેન્ડર બોલાવવામાં આવશે કોના બાપની દિવાળી? ફરીથી ટેન્ડરો મંજૂર થશે અને કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતથી ફરીથી કામ શરૂ થશે. આ વર્ષે થયેલી આ અવદશા અંગે તંત્ર દ્વારા કોઈ તપાસ થશે? કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પગલા લેવાશે? તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ચેક બાઉન્સ કેસમાં વાહન લોન લેનાર આરોપીનો નિર્દોષ છૂટકારો

ચોલા મંડળમ

ફાઈનાન્સે કેસ કર્યો હતો

પ્રતાપ પ્રતિનિધિ સુરત, તા. ૧૮ પાલ હજીરા રોડ પર સ્ટારબજારની સામે રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલ ચોલા મંડળમ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની પાસેથી વાહન પર લોન લઈ આપેલ ચેક બાઉન્સ થતાં કંપનીએ આરોપી અને ગોડાદરા લક્ષ્મીનારાયણ નગરમાં રહેતા સુનિલ .આર. સાલવી સામે નેગોસીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ૧૩૮ મુજબ કોર્ટમાં

ફરિયાદ કરી હતી. સુનાવણીના અંતે આરોપી સુનિલ સાલવી ના બચાવ પક્ષના એડવોકેટ ભાવેશ જે. અમીન ની દલીલોને ધ્યાનમાં રાખી વિદ્વાન જજ નિરવકુમાર પટેલએ ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ જતા આરોપી સુનિલ ને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંક વિગતો એવી છે કે, ગોડાદરા લક્ષ્મીનારાયણ નગર માં બી. એ ૧૨૦ માં સુનિલભાઈ આર સાલવી રહે છે. ફેબ્રુઆરી ૨૦૨૦ મા તેમણે ચોલામંડળમ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની સાથે લોન એગ્રીમેન્ટ કરી વાહન પર

ર લાખનું રૂપિયાનું ચિરાણ મેળવ્યું હતું. અને તેની સામે તેમણે સપ્ટેમ્બર ૨૦૨૨ માં પ૯,૨૦૨ રૂપિયાનો ચેક ચોલામંડળમ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપનીને આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતા ફાઈનાન્સ કંપનીના અધિકૃત અધિકારી સલમાન પટેલે નેગોસિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ મુજબની સુનિલ સાલવી સામે કોર્ટ ફરિયાદ કરી હતી. બંને પક્ષોની દલીલોના અંતે સુનિલ સાલવીના એડવોકેટ ભાવેશ જે. અમીન ની દલીલોને મંજૂર રાખી અદાલતે આરોપી સુનિલને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

પેજ-૨ પાનાનું ચાલુ

મતદારયાદીમાંથી નામ કમી કરવા, ફોટો/વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમુનામાં અરજ કરી શકે છે. ઉપરાંત voterportal. eci.gov.in તથા Vote r Helpline Mobile App પર જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે. જેથી વધુમાં વધુ મતદારોએ લાભ લેવા સુરતના અધિક જીલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યો છે.

માંડવી આઈટીઆઈ

પેજ-૨ પાનાનું ચાલુ કરવામાં આવ્યું હત

દિવાળી વેકેશનની મસ્તી પર્યા: શાળાઓમાં વિદ્યાર્થીનાં શોરબકોર સાથે શૈક્ષણિકકાર્ય પ્રારંભ



દિવાળી વેકેશન બાદ આજથી સમગ્ર રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા સત્રનો આરંભ થયો છે. શાળાઓ આજથી પુનઃ શરૂ થતા વેકેશન દરમિયાન સુમસામ બની ગયેલા શાળા સંકુલો વિદ્યાર્થીઓની હાજરીથી ફરી ધમધમતા થયા હતા.

૨૧ દિવસનું દિવાળી વેકેશન હતું

(પ્રતાપ પ્રતિનિધિ) સુરત, તા. ૧૮

દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને આજથી શાળાના બીજા સત્રનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આજે સવારે પ્રિ-સ્કૂલ તેમજ પ્રાઈમરી અને હાયર સેકન્ડરી સ્કૂલોમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. સવારના સમયે શાળાનાં પટંગણ બાળકોના કલરવથી ગુંજ ઉઠવા હતા. બીજી તરફ લાંબી રજાઓ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ થતા આ

ભુલકાઓમાં અને તેના વાલીઓમાં પણ સુસ્તી જોવા મળી હતી. જ્યારે અમુક નાના ભુલકાઓ આજે પહેલો જ દિવસ હોય રહ્યા પછી જોવા મળ્યા હતા. આજે ૨૧ દિવસના વેકેશન બાદ રાજ્યની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની સ્કૂલો રાખેતા મુજબ શરૂ થઈ ગઈ હતી. “૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ સોમવારથી શહેરના રસ્તાઓ ઉપર બાળકોને લઈ જતા સ્કૂલ વાનની ચહલ પહલ જોવા મળી હતી. હવે રજાઓના અંતે ફરીથી શૈક્ષણિક

અનુસંધાન પાના ૭ પર

પોલીસે મનપા પાસે શિવપૂજા કોમ્પ્લેક્સની જન્મકુંડળી માંગી

એસીપી વિજય મલ્હોત્રાએ કમિ. શાલિની અગ્રવાલને વિગતો આપવા પત્ર લખ્યો

(પ્રતાપ પ્રતિનિધિ) સુરત, તા. ૧૮
સુરત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવ પૂજા કોમ્પ્લેક્સમાં ૬ નવેમ્બર ની સાંજે આગ લાગતા

ગુંગળામણને કારણે બે મહિલાઓના કરુણ મોત નીપજવાની ઘટનાના પગલે ઉમરા પોલીસે જીમ સંચાલક અને સ્વા

સંચાલકની સાપરાધ મનુષ્યવધના એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫, ૧૧૦ મુજબ નો ગુનો નોંધ્યો હતો. આ ગંભીર ગુના ની તપાસ કરનાર એસીપી વિજય મલ્હોત્રાએ ગત સપ્તાહમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલને એક પત્ર લખી આ બિલ્ડીંગ બાંધનાર કોણ કોણ બિલ્ડરો હતા, ઈમ્પેક્ટ ની અરજી ક્યારે દાખલ કરવામાં આવી અને ઈમ્પેક્ટ ફી કોણે અને કયા અધિકારીએ મંજૂર કરી હતી. આ ઉપરાંત આકારણીને રિવેલેડ માહિતી પણ મંગાવવામાં આવી હતી. જોકે એસીપી વિજય મલ્હોત્રા એ મંગાવેલી માહિતી નો રિપોર્ટ હજુ સુધી મનપા દ્વારા મોકલવામાં આવ્યો નથી એવું પણ પોલીસ સૂત્ર દ્વારા

જાણવા મળ્યું હતું.

આ કેસની વિગતો એવી છે કે, સીટી લાઈટ વિસ્તારના શિવ પૂજા કોમ્પ્લેક્સ માં અમૃતિયા સ્વા એન્ડ

સહુન આવેલું છે. ૬ નવેમ્બર ના રોજ સાંજના સુમારે સ્વા એન્ડ સહુન માં કોઈક કારણોસર આગ લાગી અનુસંધાન પાના ૭ પર

સ્વા-જીમ, હોસ્પિટલની ફાયર સેફ્ટીની ફરી એક વાર તપાસ તમામ ઝોનમાં ફાયર બ્રિગેડની ટીમો તેયાર

(પ્રતાપ પ્રતિનિધિ) સુરત, તા. ૧૮

સિટીલાઈટ રોડ પર પેન્ટાલુક્સ પાસે આવેલ શિવપૂજા શોપિંગ સેન્ટરનાં ત્રીજા માળ પર જી-૧૧ માં બનેલી દુર્ઘટનામાં ફાયર બ્રિગેડે હવે શહેરના તમામ ૮ ઝોનમાં આવેલા સ્વા-જીમ-હોસ્પિટલ તથા કોમર્શીયલ કોમ્પ્લેક્સોમાં ફાયર સેફ્ટીની ચકાસણી ફરી એકવાર શરૂ કરી હોવાનું ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું. જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા પર્ચમિ નહીં હોય તેઓને નોટીસો આપવામાં આવશે એવું પણ બસંત પરીકે જણાવ્યું હતું.

બિલ્ડીંગના આર્કિટેકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરાશે

સીટી લાઈટ રોડ ની પાસે આવેલ શિવ પૂજા શોપિંગ સેન્ટર ના ત્રીજા માળ પર જીમમાં ગુંગળામણને કારણે સર્જાયેલી દુર્ઘટના માં સિક્કિમની બે યુવતીઓના મોત થયા હતા. આ ગંભીર ઘટનાની તપાસ કરી રહેલા એસીપી વિજય મલ્હોત્રાએ આજે સવારે પ્રતાપ દર્પણ સાંધ્ય દૈનિક ના સંવાદદાતા સાથે કરેલી એક ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં ગત સપ્તાહમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ અને ડિવિઝનલ ફાયર ઓફિસર હરીશ ગઢવી ના નિવેદનો નોંધાયા બાદ હવે ટૂંક સમયમાં આ બિલ્ડીંગ આર્કિટેકચર ને ટૂંક સમયમાં બોલાવી પૂછપરછ કરવામાં આવશે એવું એવું પણ તેમણે જણાવ્યું હતું.

મગદલ્લા જમીન વિવાદમાં ધરપકડ કરાયેલા મુકેશ સવાણી જેલના હવાલે

સુરત (પ્રતાપ પ્રતિનિધિ) સુરત, તા. ૧૮

મગદલ્લા ખાતેની જમીન વિવાદમાં પાટીદાર અગ્રણી મહેશ સવાણી પાસેથી પકડાયેલા રૂ. ૫.૬૧ કરોડના પ્રકરણમાં મુકેશ સવાણીના આજે રિમાન્ડ પૂર્ણ થતાં કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું વકીલ પ્રભેશ સરેયાએ જણાવ્યું હતું.

મૂળ ભાવનગર પાલીતાણાના રાણપરડાગામના વતની અને ભટાર જીવકોર નગર પાસે આશીર્વાદ પેલેસમાં રહેતા મહેશ વલ્લભ સવાણીએ વેડરોડ ગુરુકુલ સ્થિત લક્ષ્મીવાડી સોસાયટીમાં આવેલા શ્રીવિલા બંગ્લોઝમાં રહેતા પ્રવિણ ઉર્ફે પીના શામજી ગુજરાતી, ડિકરા કીષ્ણા પ્રવિણ ગુજરાતી અને

મુકેશ છગન સવાણી (રહે. વિશ્વકૃપા સોસા., સુમુલડેરી રોડ) સામે ઠગાઈ અને પૈસા પડાવવાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મહેશ સવાણીએ પ્રવિણ ઉર્ફે પીના ગુજરાતી પાસે મગદલ્લાવાળી જમીન ખરીદી હતી. આ જમીન મહેશ સવાણીએ

અનુસંધાન પાના ૭ પર

રંગબેરંગી રંગોતો, પર્વમાં મહાપર્વનો,
આતશબાજીના નયનરમ્ય દેશનો
આપણા સૌનો આનંદ અને
ઉત્સાહનો ઝગમગતા દીવડાઓના
પ્રકાશપુંજનું પર્વ
દિવાળી
તેમજ
વિક્રમ સવંત ૨૦૮૧ની મંગલપ્રભાતે
આરંભતા
નૂતનવર્ષમાં
આપને તથા આપના પરિવારને
સુખમય, આરોગ્યમય અને
સમૃદ્ધિમય નિવડે એવી પ્રભુને
પ્રાર્થના. એક શુભેચ્છક

અનતીસર્વી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ

સ્વ. સુખદેવ મોહનલાલ રાઠી
જન્મ: 6-12-1960 સ્વર્ગવાસ: 17-11-1995

આપની વિદાયે કો આગ અનતીસ સાલ હો ગયો જીવન કે મધ્યાન્હ મેં મોક્ષ માર્ગ ગ્રહણ કિયા, સશરોર હમારે સાથ ન હોતે હુપે મી આપકા અહસાસ હર પલ હમારે સાથ હૈ આપકે બનાવે લક્ષ્ય કી ઓર નિરંતર બઢ રહેં હૈ યહી હમારે લિપ આપકે પ્રતિ સચ્ચી શ્રદ્ધાંજલિ હૈ ।
પ્રમુ આપકી દિવ્ય આત્મા કો પરમ શાંતિ પ્રદાન કરે, એસી હમ સમી પરિવાર જનોં કી પ્રાર્થના હૈ ।

Maakhan Bhog પરિવાર
સુરત - વીકાનેર - જયમલસર



રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે "મફત પરિવહન સુવિધા"



સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની ધોરણ-૧ થી ૮ની સરકારી પ્રાથમિક અને ધોરણ-૯ થી ૧૨ની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સુવિધા ઉપલબ્ધ છે...

• મફત પરિવહન સુવિધા મેળવવાની પાત્રતા

- (૧) ધોરણ-૧ થી પની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર ૧-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાલ.
- (૨) ધોરણ-૬ થી ૮ની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર ૩-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાલ.
- (૩) ધોરણ-૯ થી ૧૨ની સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીના રહેઠાણનું અંતર ૫-કિમી થી વધુ હોય તેવા વિદ્યાર્થીને લાલ.

નોટ - મફત પરિવહન સુવિધાની માહિતી માટે નજીકની શાળાનો સંપર્ક કરવો
પરિવહન સંબંધિત મુશ્કેલી માટે transportspo@ssguj.in પર ઈ-મેઈલ અથવા મો-૭૫૭૪૮૦૦૭૪૦ પર સંપર્ક કરવો.